

# આધ્યાત્મિક કુરી

તાત્રી : સંપાદક : કૃતાસભાન એન. પરીઅ



॥ પરમ તેજશાંતી મા ગાયત્રી ॥

ॐ બૂલુર્દ્દિ: સવ: ॐ તત્સવિતુર્વરેણ્યં ભગ્નો દક્ષય ધીમહિ ધિયા યો ન: પ્રચ્યાદ્યાત् ॐ ॥

# શ્રી ગાયત્રી ઇન્ડિયન ટ્રસ્ટ

## અમદાવાદ - ૧૬

[ ૨૭. નં. ૩૩૬૧ ]

જાયત્રી ઉપાસક પૂજય શ્રી શાખ્બીજાંનો ( નરેન્દ્રલાઈઝ બી. એ) માર્ચ ૧૯૭૫થી આ ગાયત્રીના આદેશથી લોકસેવાનો અલિગમ સ્વીકાર્યો છે. આધિ-બ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી તેમના પ્રશ્નો સુલભાવવાનો પ્રયત્ન તેઓ વિના મૂલ્યે કરી રહ્યા છે. અસાધ્ય બિમારીથી વ્યધિત વ્યક્તિઓને પૂજયશ્રી મા ગાયત્રીના આદેશ અને માર્ગદર્શન અનુસાર શક્તિપ્રદાનની સારવાર આપી રોઅમુક્ત કરવાનો પ્રયાસ કરે છે. અલિગમનિયત જીવનજળ માનવીનું જીવન બનાવે છે અને જીવન બચાવે છે.

ભારતમાં અને વિદેશોમાં પૂજયશ્રીની સેવાનો લાભ વિશાળ જનસમૃદ્ધાયે લીધો છે અને લઈ રહ્યા છે. ધાર્મન્યુગમાં જીવતી માનવીને આધ્યાત્મિક શરણુનો સીધો, સરળ રાહ ભતાવી માનસિક શાંતિનો અનુભવ કરાવે છે.

પૂજયશ્રીના આ અનોખા અને વિરલ કાર્યઘરનો લાભ કોઈ પણ જાતિ, જાતિ, ધર્મ કે સમુદ્ધારણના વિશાળ જનસમૃદ્ધાયને મળી શકે તેવા શુભ આશ્રયથી પૂજયશ્રીની ગ્રેરણ્યા અને મા ગાયત્રીની ઇપાથી શ્રી ગાયત્રી ઇન્ડિયન ટ્રસ્ટની સ્થાપના કરવાનો એક નાન્ય પ્રયાસ કર્યો છે.

આ ટ્રસ્ટના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :

- (૧) જરીએ તથા જરિરવાના માણસોને દરેક પ્રકારે મદદ કરવી.
- (૨) કોઈ પણ પ્રકારના શિક્ષણના ક્ષેત્રમાં મદદ કરવી.
- (૩) આધ્યાત્મિક સારવાર-કેન્દ્ર સ્થાપી અસાધ્ય બિમારીભાંથી લોકોને રાહત આપાવવી.
- (૪) કુદરતી આકાશમાં સપદાયેલાઓને સહાયદ્ય થવું.
- (૫) વિશ્વબંધુત્વની ભાવના ડેળવી માનવજલને દરેક વિષમ પરિસ્થિતિમાં સહાયદ્ય થવું.

અમારા આ નાન્ય પ્રયાસને આપ વધાવી લેશો અને વેગવંતો બનાવશો તેવી નાન્ય વિનંતી.

આભાર સંકુ.

સરનામું :

કે. એન. પરીખ

મેદનનો બંગલો, સીવીલ હોસ્પિટલ કૃપાઉન્ડ,

અસારવા, અમદાવાદ-૧૬. (ગુજરાત) (ઇન્ડિયા)

ફોન : ૩૭૬૦૬૭

કે. એન. પરીખ

મેદન ટ્રસ્ટ

શ્રી ગાયત્રી ઇન્ડિયન ટ્રસ્ટ



આ તૈમાસિક અંક  
જન્યુઆરી,  
એપ્રિલ,  
જુલાઈ  
અને  
ઓક્ટોબર  
માસમાં  
પ્રગટ થશે.



વાર્ષિક લવાજમ  
રીપિયા ફસ



પ્રકાશક :

શ્રી કુલાસભેન એન. પરીખ  
શ્રી ગાયત્રી ઇલ્લિન્ઝેન ડર્સ,  
મેડન કવાર્ટ્સ,  
ન્યુ સિવિલ હાર્સિપટલ ક્ર્યુપાઉન્ડ,  
અસારવા,  
અમદાવાદ - ૩૮૦ ૦૧૬.



સુદક :

કાન્નિલોધ્ર અ. મિશ્ની  
આદિત્ય સુદ્રણ્ણાલય  
રાયઅડ,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૧

# આધ્યાત્મિક કેડી

૧૯૭ ] • જન્યુઆરી : ૧૯૮૮ • [ અંકૃત લેખ

## અનુક્રમણીકા

૧. ઉપાસનાની પરિપૂર્ણ અથે	શાખીલ	... ૩
૨. પંચામૃત	...	... ૮
૩. પૂજય ગુરુદેવના સાનિધ્યની પગોભા...	...	... ૧૦
૪. ભક્તિનો સહયોગ	...	... ૧૪
૫. જોવાયેલ દાગીનો પાછો મળ્યો !	...	... ૧૬
૬. છેર્ધન હેમરેજમાર્થી મુક્તિ !	...	... ૧૭
૭. જીનગોઢિ	...	... ૧૭
૮. અમૃત આચમન	ડૉ. કાન્નિલોધ્ર કાલાણી	... ૨૨
૯. ઉપાસનાના આરંભે	...	... ૨૪
૧૦. સૂક્ષ્મ ઉપરિથિતિ	...	... ૨૬
૧૧. કાયુપ્રસાદ	શ્રી તપસ્વી નાન્દી	... ૨૭
૧૨. સમાચાર	...	... ૨૮



આપનું સન ૧૯૮૮ ના વર્ષનું 'આધ્યાત્મિક  
કેડી'નું લવાજમ રીન્યુ કરાવી લેવા વિનંતિ.  
પાંચ વર્ષનું એકસામદું લવાજમ  
સ્વીકારવામાં આવે છે.





આધ્યાત્મિક કુડી

જાન્યુઆરી : ૧૯૮૮



## ઉપાસનાની પરિપૂર્તિ અર્થે

### શાસ્ત્રીણ

**ધ**ણાં મુલાકાતીએં તરફથી અવારનવાર પ્રારો થતા રહે છે કે ઉપાસના કરવા આટે શું કરવું ? આધ્યાત્મિક ભાગે કેવી રીતે જવાય ? ઉપાસનામાં આગળ વધવા શું કરવું ?

ને કોઈ વ્યક્તિ ભારી મુલાકાતે આવે છે તેઓને ભાતાજીના સંકેત પ્રમાણે હું ગાયત્રી ભંગની વિષુ ભાગા કરવા તો કહું જ ખું એટલે તેઓ તે પ્રમાણે શરીર કરી હે. ભારી મુલાકાત વિના પણ જેમને વિધાસના કરવાનું ભન થાય તો તેઓ પોતપોતાના ધ્યાનની કે ગાયત્રી ભંગની વિષુ ભાગા દરરોજ કરવાનું ચાલુ કરે.

હેનિક ઉપાસનામાં વિષુ કે પછી મેં કહ્યા પ્રમાણેની ભાગા શરીર કર્યા પછી ધ્યાન કરવાનું છે. પોતાના ધ્યાનદેવ કે ભાતાજી સમક્ષ જેસી બની શકે તો પ્રાતઃકાળે ચાર વાગ્યે કે રાત્રે દ્વાં વાગ્યે ધ્યાન કરવાનું થાય છે.

જ્વપ અને ધ્યાનનો આરંભ કર્યા પછી મેં નવ સુત્રો આપ્યાં છે તેનો ને અમલ કરી શકો તો ચોક્કસ તમારા લૌટિક ને આધ્યાત્મિક જીવનમાં શાંતિ ને આનંદનો અલૌકિક અનુભવ થશે. સુધળા શાશ્વતોનો સાર એક જ છે કે બસ, અગવાનને એળખ્યા એની અક્ષિલ કરે. એનામાં શ્રદ્ધા, વિશ્વાસ રાખો. એને શરણે જવ. આથી હું એમ માનું ખું અને ભારો સ્વાનુભવ છે કે ઉપાસના કરવા ધ્યાનારે કોઈ અણ પ્રકારના વિધિવિધાનમાં કે બાબુ પળોજણ્યા અટવાયા વિના, સમૃદ્ધ શ્રદ્ધા અને શરણાગતિધી નિષ્ઠામ ભાવે, ભા-આગનેનો સમ્બન્ધ કળના પોતાના ધ્યાનની ઉપાસના ( ગાયત્રી ભંગની વિષુ ભાગા ) કરવાની શરીરાત કરવી જોઈએ.

યોગશાસ્ત્રમાં યોગસાધના ભાટે સાધકે પાચ નિયમો પાળવાનો કહ્યા છે :

(૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય અને (૫) ધર્શર પ્રણિધાન.

હવે યોગશાસ્ત્રના કદાચ અડકાવનારો શબ્દ લાગે ને એવા દુષ્કર કાર્યને વ્યક્ત કરતા શબ્દથી જ દ્વારા જરૂર, એ તરફ બદ્ધ પણ ન આપીએ એવું બને. પણ કોઈએ ગલરાગાની જરૂર નથી. આપણે યોગશાસ્ત્રના કરવી પણ નથી. હું તમને તેમ કરવા કહેતો પણ નથી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે યોગશાસ્ત્રમાં ને

આધ્યાત્મિક કુડી, જાન્યુઆરી, '૮૮ ]

પાંચ નિયમો આપણા છે તે તરફ આપણે ધ્યાન આપીએ ને તે સમજ આવરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. આપણે સામાન્ય દૈનિક કલ્પના ઉપાસનાને જ લક્ષ્યમાં રાખીને આ પાંચ નિયમો જરૂરવાનો પ્રયાસ કરીશુ.

શૌચ એટલે સ્વચ્છતા - પવિત્રતા. આપણે સ્નાનશૌચાહિથી સ્વચ્છ ને પવિત્ર થઈ એ છીએ પણ અહીં શૌચ ભાવ તો ખરું, પણ આંતરિક પણ હેઠળ જોઈ એ. ભાવ શૌચથી - સ્નાન વગેરેથી શરીર સ્વચ્છ બની પ્રસન્ન ને સ્કુર્ટિં અનુભવે છે, પણ માનવીની અંદર પણ શૌચ જરૂરી છે. અંદરનો શૌચ એટલે માનસિક પવિત્રતા - એમાં મન, વચ્ચન ને કર્મની પવિત્રતા પણ આવી જાય. સત્યપરાયણતા, ઇયા, પ્રેમ, સહદ્દિતતા વગેરે પણ જરૂરી છે. અર્થાત્ માનવીનો - ઉપાસકનો આચારવિચાર પણ શુદ્ધ, સાત્ત્વિક, પવિત્ર, ઉદાત્ત ને ઉમદા હોવા જરૂરી છે.

પણ મહિનતાનો અનેક આવરણોથી ઘેરાયેલા માનવીમાં આંતર શૌચ હ્યારે ઉદ્ભવી શકે? ઉદ્ભવી શકે, એ માટે સ્વાધ્યાય જરૂરી છે.

ખીજુ વાત છે સંતોષની. માનવીને જ્યારે ને કંઈ આવી અણે તેમાં તે આનંદ ને સંતોષ રાખે તો સ્વસ્થતા ને શોંભિ અણે છે. એમાંથી જ માનવીની - ઉપાસકની ચિત્તની રિથરતા - એકાયતા ડેળવાય છે. 'આધ્યાત્મિક ડેડી'ના એપ્રિલ '૮૬ના અંકમાં 'આત્મસંતોષ'ના લેખમાં મેં વિરતુત છાલુંબટ કરી છે એટલે એનું વધુ પિંજણું અહીં નહીં કરીએ.

માનવીએ અહીં જ બાધ્યતમાં સંતોષ ડેળવી ચિત્તને એક માત્ર પરમતત્વમાં જ એકાય ડરું, ધ્રદ્યસ્સુખ - સંસારસ્સુખ - મેળવવાની સાથે સાથે જ એનાથી નિદેંખ - જગકેળવત અની ઉપાસના કરેવામાં આવે તો તે એક તપ બની જાય છે. અહીં ને તપનો જીલ્સેખ કર્યો છે તે આ છે. તપ એટલે ગૃહીત્યાગ - સંસારત્યાગ કરી પલાંઠી વાળા ધ્યાન ધરી એસી જવું એ તપ નથી. ને એવિભુનિઓએ એ પ્રકારે તપ ડર્યાં છે ને કરે છે તે ખૂબ દુષ્કર કાર્ય છે. સામાન્ય મતુધ્ય માટે એ કંઈ નથી, એવી ડોઈ આવરણકરતા પણ નથી. ભારી મનત્ય પ્રમાણે તો જીવન ને સંસારની અનેકવિધ પગાજણો વચ્ચે રહીને પણ દૈનિક ઉપાસના ને પ્રેસંગોપાત્ર યોજનાબદ્ધ જીર્તપૂર્ણ ઉપાસના કરીએ તે જ ઉચ્ચિત છે. એમાં જ માનવીની અનેકવિધ કસોટી યાય છે. માનવી એમાં ધર્ષું જ તરે છે. એ એક પ્રયર તપ મારી દધિએ છે.

સ્વાધ્યાયમાં ઈષ્ટહેવના મંત્રભર્તું સાતલ્ય - નિરંતરતા સ્થયવાય છે. વારંવાર - સતત મંત્રભર્તામાં સુભરણું કર્યાં કરવાથી સમય જતો ઈષ્ટની પરમતત્વની કૃપાની અલોહિક અનુભૂતિએ થાય છે. ચિંતા તેજાલાર્દી વિરોધ એકાયતા સાથે છે ને અસ્તિત્વ પરમતત્વને માટે અધીર ને ઉંઠાય બનતો આત્માનુસંધાન - આત્માભસાક્ષાત્કારની ડોટિએ લઈ જાય છે. તેથી જ શાશ્વતી વારંવાર, સતત ઈષ્ટરતું સુભરણું - જપ કરવાનો આદેશ આપ્યો છે. માનવીની ચેતના પરમ ચેતના સાથે અનુસંધાન સાધતો ઉપાસનાતી-યોગસાધનાતી એ સિદ્ધિ અની જાય છે. યોગસાધનાતી - ઉપસનાતી સિદ્ધિ મેળવવા સ્વાધ્યાય - વારંવાર - સતત જપ ને નામરસમરણ - એક પગથિયું છે. મને લાગે છે કે ડોઈ પણ ઉપાસક માટે એ પગથિયું ચડવાનું આસાન - સરળ અની રાફરી. આમ કરવાથી સહજભાવે જ ચિત્ત ઈષ્ટરમાં અનાયાસે જ એકાય અની જાય છે. તેણું સતત ધ્યાન યાય છે ને કર્યું જોઈ એ એમ હું માનું હું. ઉપાસકે સતત ઈષ્ટના શરણમાં રહેવાઈ છે. એટલું જ નહિ, શરણાગતિની અનન્યતા સિદ્ધ કરવાની છે.

ઇંદ્ર - ઈશ્વર પ્રત્યેના ભાવની-પ્રેમની - શરણુગતિની અનન્યતા એ ઉપાસકનો સ્ફુર્તમ ખોજ્યાપાર છે. પણ એ માટે ઉપાસના બાબત - આધ્યાત્મિક બાબતોમાં પણ કાઈની રીકા કે નિન્હા કરવી હચિત નથી. પણ ઉપાસકો ખૂબ સારી રીતે ઉપાસના કરે છે, પણ મનમાં એક પ્રકારની અંધિ અંધાઈ બઈ હોય છે કે એ ને જેવી રીતે ઉપાસના કરીએ છી તે જ સાચી છે. અમૃક જણુની અદ્ધા, ઓછી છે. અમૃક હેવ મોટા છે. અમૃક મન્ત્ર સિદ્ધિહાયક છે, અમારી ઉપાસના જ યોગ્ય છે. કૃષ્ણ મોટા ને શિવ નાના, શિવ મોટા ને કૃષ્ણ નાના છે એવી માન્યતા આજે પણ પણ ઉપાસકોમાં જેવા મળે છે, જે ખૂબ જ આમક ને ભૂલભરેલી છે. એક શક્તિ - એક ઈશ્વરમાથી ઉદ્ભવેલા જુદા જુદા સમુપ્રદાયી મજુષ્યમાં - ઉપાસકમાં જેહની દાખિ નિર્માણ કરે છે.

પરન્તુ યાદ રાખવું જોઈએ કે ઈશ્વર એક જ છે. આ સંદ્રિમાં એક જ ચેતના વિલસી રહી છે ને એના આધિપત્ય હેઠળ સૌઅં જીવન ધારણ કર્યું છે. સમયાન્તરે તેનાં જુદા જુદા નામ પડ્યાં, સમુપ્રદાયો - વાડાએ નિર્માણ થયા ને જેમાંથી ધર્મને નામે ઊંડાએ જિલ્લા થયા. વ્યક્તિનો આવો દાખિબેદ્ધ શરણુગતિની અનન્યતા પર પ્રહાર કરે છે.

માનવી - ઉપાસક ખીલ હેવની ઉપાસનાને-ખીલના હેવને નીચા માની તેની નિન્હા કરે તે યોગ્ય નથી. તેમ કરવાથી ઉપાસક અંતતોગતવા પોતાના જ હેવની અવમાતના કરે છે. પરમતત્ત્વની શક્તિ તો એક જ છે. એક વ્યક્તિ જેની ઉપાસના કરે છે તે શક્તિ જ અન્ય ઉપાસકની ઉપાસનાના સ્વરૂપમાં પણ સંનિહિત છે. એટલે બન્ને વ્યક્તિ આખરે તો એક જ શક્તિને - પ્રલુદે ભાજો છે.

ઉપાસક પોતાના ઈશ્વરેવમાં અનન્ય ભાવ રાખવા છતો, ખીલના ઈશ્વરેવને પણ પોતાના જ ઈશ્વરેવનું ઇપાન્તર સમજુને તેમનો પણ આદર કરવો જોઈએ. કાઈ પણ ઈશ્રમાં એક આત્મ અલુનુમાં પરમાત્માના જ દર્શન કરવાં એ જ સાચી અનન્યતા છે. એવો અનન્ય ભાવ ડેળવાશે તો જ ઈશ્વર જ્ઞાયે અતુસંધાન સાધી શકાશે. અદ્વૈત ડેળવી શકાશે અને અનન્ત શક્તિના આશ્રે રહીને એ શક્તિને પોતાનામાં જંચિત સંકાન્ત કરી શકાશે. વીજળાના ગોળાને તેના પ્રકાશથી પ્રજન્નવલિત કરવા યોગ્ય સ્વિચ્છાવવાની જરૂર રહે છે તેમ અનન્ય ભાવ દ્વારા જ સ્વત્તી ચેતનાને પરમ ચેતના જાયનેદી રાકાય છે.

મતુષ્યે - ઉપાસક પોતાની અંદરના શત્રુથી જ્ઞાવં રહેવાનું છે. ઉપાસનામાં જતને સમૃપૂર્ણપણે લીન કર્યા પણ પણ નિશ્ચિંત ને અસાવધાન રહેવું યોગ્ય નથી. અંદરનો એકાદ શત્રુ પણ જીવંત હોય ત્યાં સુધી જ પાને ન એસવું. અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ અજમાવીને, પોતાના પરમ મિત્ર ને આત્મા-કારી સેવકનો સ્વાંગ સજુને પણ વ્યક્તિને તે ભરમાવી શકે છે. તેની ચાલ ખૂબ જ કપટભરી હોય છે. 'તમાં વિશ્વાસ ન રાખતો સતત સાવધાન-સળગ બનીને રહેવું. કાઈ પણ અસ્ત ખૂબેથી તેનો પ્રહાર થઈ શકે છે. એટલે અનદરના શત્રુએને - તમામ આંતરિક મલિનતાએનો પરિહાર કર્યા પણ જ પરમ પવિત્ર, સનાતન, દિવ્ય, અલૌકિક ઈશ્વર હૃદયમાં - અરિતત્વમાં બિરાજમાન થર્ધ શકે છે. ઈશ્વરનો પાવનકારી રૂપના પામવા આટે પણ માનવીએ-ઉપાસકે પહેલાં સ્વયં પાવન બનવું પડે છે.'

મેં સુયોગ પ્રમાણે ઉપાસનાનો આરંભ કર્યો - પછી સૌથી મોટી આવશ્યકતા તો ઉપાસનાની નિયમિતતા ડેળવવાની છે. અર્થાત ઉપાસના દરરોજ જ કરવી, ધ્યાન દરરોજ કરવું, જેટલી માળાનો આડેજ મળ્યો. હોય તેટલી માળા દરરોજ અચૂક કરવી જ કરવી. પાચ માળાનો આદેશ મળ્યો. હોય તો પાંચ માળા રોજ કરવી. એ પછી જતે નક્કી કરી લેવું કે રોજ ડેટલો મે કઢ્યો. સમૃદ્ધ અલુકૂણ છે

ને પરમાત્માના સમરથું-ઉપાસનામાં કાળવી શકોએ તેમ છીએ તો તે ને તેટલો સમય અચૂક ફરજિયાતપણે ઉપાસનામાં કાળવવો જ રહ્યો. સંજેગવણાત્ અમય કે સ્થળના ફર પડી શકે તો વાંધો નથી, પણ દૈનિક કમર્મા તો એ અચૂક સાચવી શકાશે.

સમગ્ર ઉપાસનાની પરિપૂર્તિ અર્થે વૈરાગ્ય ખૂબ જ મહત્વની ને જરૂરી બાબત છે.

શ્રીમહ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અગવાને મનની ચંચળતાને દૂર કરવાના ઉપાય તરીકે વૈરાગ્ય અને અભ્યાસને મહત્વના લેખ્યા છે. તેમણે કહ્યું છે કે મન તો વાયુ (પવન) જેવું ચંચળ છે ને તેને અભ્યાસ ને વૈરાગ્યથી કાય્યું લાવી શકાય છે. -

અભ્યાસ એટલે સ્વાધ્યાય-ઉપાસનાનું-સાતત્ય તે અગ્રે આપણે ઉપર જોઈ ગયા.

હવે વૈરાગ્ય એટલે શું તે જોઈએ.

વૈરાગ્ય એટલે સંસાર ને સમાજનો ત્યાગ કરી અગવાં ધારથું કરી, દાઢી, મૂળ, વાળ વધારી અસમૃદ્ધેન કરી જંગલમાં ચાલ્યા જવું, સમાજ કે સંસારની જવાખદારીમાથી ભાગી ધૂટવું એવો અર્થ વૈરાગ્યનો કરવાનો નથી. કથારેક જીવનની એક થા અન્ય નિષ્ઠળતાથી નિરાશ, હતાશ થઈને કેટલાંક ભાઈ-ભહેનો ભારી પાસે આવે છે. તેઓ ધર છોડવા કે આત્મહત્યા કરવા તત્પર થઈ જય છે. ધર છોડવા ધરણનારને હું પહેલો પ્રશ્ન એ કરું છું કે તું પાછો કથારે આવીશ? આત્મહત્યા કરવા તત્પર થયેલાને મંત્રલયથી તેના મનમાં ઉદ્ભલવેલા આત્મહત્યાના વિચારને, તેની આશાને અંદેરી નાખવાનો પ્રયાસ કરું છું, મંત્રલયથી સમય જતાં જીવન પ્રત્યેનો તેનો સમગ્ર અભિગમ જ બદ્લાઈ જાય છે. આવા અધા-હતાશ થઈને ધર છોડવાનો કે આત્મહત્યા કરવાનો, વગેરે વિચારો ક્ષણિક વૈરાગ્ય છે. એને સમયાન-વૈરાગ્ય કહે છે.

જીતામાં અગવાને ચંચળ મનને કાય્યું આશ્વયા જે વૈરાગ્ય કહ્યો છે તે કહ્યો ને કહ્યો વૈરાગ્ય એવો પ્રશ્ન સહેલે કોઈને ઉદ્ભબને.

અગવાને જન્મ - જીવન આપ્યા છે એટલે એને પૂરેપૂરી ન્યાય આપવાની ફરજ છે. પણ સાંસારિક સુર્પાપભોગમાં સંસારની - જીવનની ધરતિશ્રી નથી. સંસારમાં રહીને સાંસારિક સુર્પાપભોગ બોગવતાં બોગવતાં, સાંસારિક-સામાજિક જવાખદારીએ અહા કરતાં કરતાં પણ એ બધાથી નિર્દેશ-જળિકમળવત્ત અનીને એક ભાગ પરમાત્મામાં - ભાતાજુમાં ચિત્તના સમસ્ત મનોધ્યાપારને લીન કરી દઈ જીવન જવું, ધન્દિયજનિત તમામ પ્રકારની લાલસાને, લોભને, લાલચને, અંદરના તમામ શરૂઆથી માંદ અનીને - સંજગ રહીને જીવન જવું - ઉપાસના કરવી, સંસારમાં રહેવા જતાં કોઈ પણ પ્રકારની કૌતિક આસક્તિમાં ચિત્ત આસક્ત ન થાય તારે જ સાચો વૈરાગ્ય ઉદ્ભલવેલો કહી શકાય. સંસારમાં રહેતો હોવા જતાં તમામ પ્રકારના સાંસારિક લેપનથી અલિપ્ત રહેતો સંસારી માણુસ સાચો સાંપુ રહેવાય છે. ઉપાસકે એવું સાંપુજીવન જીવવાનો અભિગમ કેળવવો જોઈએ. સંસારમાં રહેવા જતાં સંસાર પ્રત્યેની અલિપ્ત જીતિ જ માનવીમાં - ઉપાસકમાં વૈરાગ્ય જન્માવે છે. અગવાન જીતામાં એ જ કહે છે કે સંસારમાં રહો, પણ એથી લેપાએ. નહિ. સંસારમાં રહીને પણ અલિપ્ત-નિર્દેશ જીવાં કેળવાય તો ચિત્ત એની મેળ રિથર, ઝાત, એકાય યવાનું જ છે.

આવો વૈરાગ્ય કેળવવા માટે સથળું પરમાત્માના હાથમાં સોંપી ઉપાસના શરીર કરવામાં આવે તે જરૂરી છે. તેમ કરત૊થી ને શરણાગતિનો ભાવ મનમાં ઉદ્ભલવણે ધર્થરની કૃપાના - આશિષનો અતુલભવી ધરી ને ધીમે ધીમે સાંસારિક પદાર્થી તરફથી મન જાહી જરી. સંસારની અસ્ત્રાતા ને જીવનનું સાર-

તરવ શેમાં છે તે સમજશે. આ વૈરાગ્ય કેળવવો પણ ખૂબ દુષ્કર છે, તેમ છતી ખણ્ણમાં અદ્ધા ને શરણ્ણાગતિ રાખવાથી તે ધીમે ધીમે કેળવાતો જરૂર. નેમ નેમ અરિતવમાં વૈરાગ્ય પેદા થતો જરૂર તેમ તેમ ઉપાસનાની નિયમિતતાથી, મેં કહેલ સુત્રોના પાલનથી, અંતરના ઊંડા ભાવથી, પ્રેમથી, અદ્ધાથી, શરણ્ણાગતિથી ઉપાસના સારી રીતે થઈ શકે છે. આગળ પણ વધી શકાય છે. વૈરાગ્ય વિનાની અક્ષિને અલ્પિત નથી. નેમણે ઉપાસના ક્ષેત્રે આગળ વધું જ છે તેણે સંસારમાં રહીને સંસારિક્તા છાડવાની છે, જવાખદારીએથી વિસુદ્ધ થયા વિના ઉપાસના કરવાની છે. ચંચળ મનને કાખૂના લેવા વૈરાગ્ય કેળવવાનું સૂચન કરીને ભગવાને જીવન, સંસાર ને ઉપાસનાને બંધુ મેરો અભિગમ વ્યક્ત કર્યો છે. ઉપાસના ક્ષેત્રે પદાર્પણ કર્યા પછી દર્શનની પણ અભિલાષા સેવ્યા વિના નિરંતર એક ચિંતા, અનન્ય ભાવે જે ઉપાસના કરવામાં આવે ત્યારે જ વૈરાગ્યની અને વૈરાગ્યના આલાંબનથી ઉપાસનાની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. એવો વૈરાગ્ય આધ્યાત્મિક ક્ષેત્રે આગળ ને આગળ વધારી આત્મસાક્ષાત્કારની-ઉપાસનાની સરેતમ ટોચ પર પહેંચાડી શકશે.



શુલેષણ સહિત :

બર : ૩૬૫૦૫  
ઇકટરી : ૪૨૧૫૪

## ડૉ. જ્યંત વાડીલાલ ગીલીટવાલા

દરેક જાતને જરી કર્સખ ગીલીટ કરનાર



# ડૉ.કટર જ્યંત કેય્પ્રીક્સ

હેવી ટ્રેસ મટીરીયલ્સ પોલીસ્ટર

: ઇકટરી :

લોઈ નં. ૧૩/૧, ઘટાદરા  
અધના રોડ, સુરત

૪૪

: રહેઠાણ :

૬/૫૬૮ કોટસફીલ્ડ રોડ,  
સુરત-૧

આધ્યાત્મિક ફેડો, જાન્યુઆરી, '૮૮ ]

૭

## પંચામૃત

**ગ**રુ એ સાક્ષાત્ પરથન છે એમ કહેવાયું છે, પણ ગુરુમાં રહેલા એ સાક્ષાત્ પરથનની અનુભૂતિ કૃવચિત ડોર્ડિક વિરલને જ થાય છે, એમાં યે વ્યક્તિની શક્તિ અને શરણાગતિ ઉપરાંત, તેના પૂર્વના પુણ્યો। પણ વધુ મહત્વનો લાગ કરજવે છે. પરન્તુ એ શક્તિ, શરણાગતિ અને પુણ્યોના સમન્વયથી જ્યારે ગુરુમાં સ્વયં પરમાત્માનાં - માતાજીનાં-દર્શન થાય, સ્વખનમાં કે અન્ય કોઈ રીતે, શુદ્ધ સ્વયં સામે ચાલીને કહે કે પરમાત્મા આરી સાચે જ છે, ત્યારે એ અનુભૂતિ અલોકિક, દિવ્ય, આનન્દમદદ ને ઇંવાડી ખડાં કરી હે તેવા બની રહે છે અને જ્યારે ગુરુ સ્વભુષે આમ કહે ત્યારે સાંભળનારને માતાજીનાં દર્શન કરવાની ધર્યા થઈ આવે, તે સહજ ને સ્વાભાવિક છે. વ્યક્તિ ચોતે માતાજીનાં દર્શન કરવા સહ્યાદ્રી બને તે સાચે જ નોંધપાત્ર ને અલિનંદ્નીય આખત બની રહે છે.

અમદાવાદની ગુજરાત રટેટ કો. ઓ. એન્કના જનરલ મેનેજર શ્રી મહેન્દ્રભાઈ વ્યાસનો આવો જ જોઈ અનુભવ અને પ્રસ્તુત કરેં છે, જેના દ્વારા આ હક્કીકત સમજાશે. તેમણે પોતાનો અનુભવ વર્ણવાની જણાયું હતું કે,

‘આમ તો પરમ પૂજ્ય શાંખીજી અમદાવાદમાં હોય, બહારગામ હોય અથવા તો પરહેલા હોય ત્યારે સ્વખનમાં મને ધર્યી વખત દર્શન આયે છે. આ રીતે પૂજ્ય શાંખીજીએ સ્વખનમાં દર્શન આપીને મારા ઉપર ધર્યી વખત કૃપા કરી છે. પરન્તુ કોઈ વખત પ્રસંગ લખવાતું મન થયું હોય તેવું જન્મુનથી. અથવા, આ રીતે પૂજ્ય શાંખીજીના દર્શનની કૃપાનો ઉલ્લેખ પૂજ્ય શાંખીજી સમદ્ધ હેમજ પૂજ્ય શાંખીજીના સાનિધ્યમાં મા ગાયત્રીના પરિવાર સમક્ષ કહેવાનો અને મારી કૃતસ્તતા વ્યક્તા કરવાનો જોઈ કરતો વધુ વખત પ્રસંગ આપ્યો છે. પરન્તુ આ વખતે પૂજ્ય શાંખીજી વિદેશના પ્રવાસે - લાંડન અથવા હતા તે વખતે મને સ્વખનમાં તેઓશ્રીના દર્શન થયા તે પ્રસંગ લખવાતું ખૂબ જ મન આય છે અને તે ટણી પણ શકતો નથી. આ પ્રસંગનું નામ મેં ‘પંચામૃત’ આપેલું છે તેનું સાર્થક પ્રસંગનું વર્ણન સાચિત કરી આપશે. આ પ્રસંગ નીચે પ્રમાણે છે :

તા. ૨ જુ. ઓગસ્ટ, ૧૯૮૭ને રોજ સંવારના પાંચ વાગ્યે પૂજ્ય શાંખીજીનાં સ્વખનમાં દર્શન થયા. કોઈ વિશ્વાળ જગ્યાએ પૂજ્ય શાંખીજીના દર્શને ધર્યી માણુસો આવ્યાં છે. તેમાં પૂ. કેલાસાહેન, અ. સૌ. કુસુમખહેન, અ. સૌ. ઉખાખેન અને મારી પત્ની સિવાય ખધા જ અજાસ્યાં માણુસો છે. આમ, જાણીતી વ્યક્તિઓમાં મારા સહિત પાંચ માણુસો છે. પૂજ્ય શાંખીજીના સાનિધ્યમાં તેઓશ્રીની નજીક જર્તા એકદમ હવા ગરમ લાગે છે અને તેઓશ્રીની તદ્દન નજીક જર્તા સખત ગરમીનો અનુભવ આય છે. એઠલે, મેં શાંખીજીને પૂછ્યું હે, માતાજી તમારી પાસે છે? આ પ્રશ્નના જવાબમાં તેઓ જોડું હરયા અને એલ્યા, ‘તમને અખર પડી ગર્દ લાગે છે, પણ હું જ માતાજી હું તેવું અત્યારે માની હો.’ મેં તેમને વિનંતિ કરી કે માતાજીના રેવક્ષે મને દર્શન આયે. દરીથી તેઓ હરયા અને કહ્યું - ‘સારુ’. એટલું કહેતાની વારમાં શાંખીજીની આજુઆજુ તેજેમય પ્રકાશપુંજ છવાઈ ગયો અને એ પ્રકાશપુંજમાં શાંખીજી અદર્શ થઈ ગયા. ધીમે ધીમે પ્રકાશપુંજ કમશા: ચોણો થતાં થતાં અદર્શ થઈ ગયો અને માતાજીના સ્વરૂપે શાંખીજીના દર્શન થયાં. વિસ્મયની સાચે હું પૂ. શાંખીજીના સ્વરૂપે લિખેલા પરિવર્તનના સ્વરૂપમાં માતાજીને મનોમન પ્રણામ કરી જિબો હતો. તેવામાં માતાજીએ મને એંચીને પોતાના જોગામાં

લઈ શીંગો અને મા પુત્રને જે વહાલથી ઝોળામાં લઈ ને પંપાળે એવા વહાલથી ભારા ભાથા ઉપર હાથે  
ઝેવા લાગ્યા.

આવું થોડી વાર બન્યું હશે એટલામાં પૂ. કૈલાસઅહેનની નજર આ દર્શય ઉપર પડતાં ખધાને  
કહેવા લાગ્યા કે સૌ માતાજીનાં દર્શાન કરો. આ અમૃતય અવસર છે, તેનો સૌ લાભ લઈ દો. એટલામાં  
દર્શાન કરવાને ખફે કેટલોક જણું માતાજીના ચરણુરૂપશ્રી કરવા માટે હોડ્યા. પરન્તુ, માતાજી પાસે પહેંચે  
તે પહેલાં જ માતાજીએ આકાશગમન કર્યું અને અવકાશમાં ફરવા લાગ્યા. હું પણ પૃથ્વી ઉપર સૌની  
સાથે માતાજીને નિહાળતો જિંબો હતો, એટલામાં માતાજીએ પોતાના એ હાથ ઊંચા કર્યા. ઇરી વાર  
પ્રકાશપુંજ માતાજીના હાથના ડોડા સુધી છવાઈ ગયો. માતાજીના હાથ દેખાતા અદરસ્ય થઈ ગયા.  
થોડી વારમાં પ્રકાશપુંજ ધીમે ધીમે ઓછો થતો અદરસ્ય થઈ ગયો. અને માતાજીના હાથમાં એક ધડો  
આવી ગયો. આ ધડો લઈ ને માતાજી આકાશમાં ફરતો ફરતો હું જે જગ્યાએ જિંબો હતો તેની બરોઅર  
ઉપર આવીને ધડો જિંદો વાળ્યો. અને ધડામાં પંચામૃત લયું હતું તે તમામ ભારા ભાથા ઉપર  
ઢોળા દીધું.

માતાજી ઇરી અવકાશમાં ચાલ્યાં ગયા. તેમના હાથ ઊંચા હતા. હાથમાં ધડો હતો. ઇરી વાર  
પ્રકાશપુંજ છવાઈ ગયો. ધડો અદરસ્ય થઈ ગયો. થોડી વારમાં પોતાના ભૂળ સ્થાને આવીને બેસતાં વેંત  
જ પ્રકાશપુંજ છવાઈ ગયો અને ધીમે ધીમે પ્રકાશપુંજ ઓછો થતો પૂ. શાસ્ત્રીજ પોતાના ભૂળ સ્વરૂપમાં  
બિરાજમાન થયેલા દશ્શિમાન થયા.

મનુષ્ય-સરીર પંચમહાભૂત ને પૃથ્વી, આકાશ, વાયુ, જળ અને  
અગ્નિ. જેના સમન્વયથી મનુષ્યની લૌટિક - દૈહિક કે શારીરિક હસ્તિ-મનુષ્યનું અર્સિતત્વ નિર્માણ પામે છે.  
આ શારીરિક અર્સિતત્વ પરમાત્માની કે ડોઈ પણ ધૃષ્ટની શરણ્યાગતિ સ્વીકારી ઉપાસના આદ્ધરી પરમ-  
તરત્વના કે ડોઈ સ્વરૂપે દર્શાન કે સાક્ષાત્કાર પામવા શક્તિશાળી બને છે ત્યારે પંચમહાભૂતના તે પાંચે  
તરત્વો અમૃત સમાન બની જાય છે અથવા અ-મૃત અર્થાત્, ચિરંજિવ-શાશ્વત તરત્વનો અનુભવ કરે છે.  
જીવન અમૃતમય-ધન્યતાનો સંતોષ પામે છે. જીવનના આધારભૂત પાંચે થ તરત્વો માતાજીના દર્શાન  
કરાવી અર્સિતત્વને અલોકિક અનુભૂતિ કરાવી જીવન ધન્ય બનાવી હે છે. જીવનના એ પાંચે સારભૂત તરત્વો  
અમૃત સમાન બની જાય છે.

અણી માતાજીના હાથમાં ને ધડો અદરસ્યણે આવે છે તે ધઠના પણ સૂચક છે, જે માતાજીની  
અલોકિક શક્તિની ઘોટક છે.




□ જ્યે ગુરુદેવ — જ્યે ગાયત્રી માતા □



રમેશભાઈ ડોક્ટર સિંહક મિલ્સ

અટોઅંડ્રા — સુરત — ટે. નં. ૪૨૧૫૪

## પૂજય ગુરુહેવના સાનિધ્યની પુળોમાં.....



**મુલાકા** ગશાર મહિનાની સાંજનું સાત્રાજય કચારનું પૃથ્વી પર પથરાઈ ચુક્કું હતું. શિયાળાના દિવસની એ વહેલી સાંજનો અંધકાર ગાડ લાગતો હતો. ધડિયાળનો ડાંડા તો હજુ સાતનો આડક વટાવીને જ આગળ વધ્યો હતો. સમરત વાતાવરણું આહલાદકતા ને અલૌદિક શાંતિનો અનુભવ થતો હતો. એવા વાતાવરણું શાખીજીના સાનિધ્યમાં સત્તસંગ-દર્શનના આશયથી કેટલાક ભક્તો આવાને બેઠાં હતાં. સામે જાબેદો લીમડો ઝૂકીને જાણે શાખીજીને પ્રણામ કરી રહ્યો હતો. સંમુખ બેઠાં સૌને આશીર્વાદ આપી વાતનો આરંભ કરતાં ચુનુદેવે ડાંડું,

‘આજે એક બહેન મારી મુલાકાતે આવ્યાં હતાં. તેમની હકીકત એવી હતી કે તે બહેન આઠથી દસ વર્ષની વયજૂથના ત્રણું બાળકો સાથે પતિગૃહે સુખેથી સંસાર વિતાવતો હતાં. સમયાન્તરે સામે બારણે રહેતા એક જાઈ સાથે પરિચય થયો. પરિચય ધીમે ધીમે ગાડ થતો ગયો. એક વાર નાણુંબીડ પડતાં તે ભાઈએ આ બહેનને પૈસાની પણ મહદ્દ કરી. આવી નિકટતા અને આત્મીયતા ગ્રેમસંબંધમાં પરિશુભી. ધરમાં પતિ-પત્ની વચ્ચે આથી કંકાસ શરૂ થયો. હાર્ષપત્રમાં તિરાડ પડી. પતિ-પત્ની વચ્ચેની આઈ પહોળા થતી ગઈ ને એક દિવસ આ બહેન પોતાના પતિ સાથે છુટ્યાછેડા લઈ, ધર છોડી, બાળકો

[ આધ્યાત્મિક ડાંડી, જાન્યુઆરી, '૮૮

આથે, કહેવાતા પ્રેમી સાથે લગ્ન કરી તેને બેર રહેવાનું શરૂ કર્યું. દિલ્સો વાતતા, અહિનાઓ પસાર થતાં, પેલા પ્રેમીનું અસલ પોત પ્રકાશના માંડયું. હાર, જુગાર અને અનીતિના કુઠંહે બેલા એવા પેલા આઈનું આવું સાચું, અસલ રૂપ પ્રગર થયું. તેણે આ બહેનને એટલે સુધી કહ્યું કે તે તેનાં આળડોને પણ અઠંગ ગુનેગાર બનાવવા માગે છે. જીવન અસલ્ય થઈ પડ્યું... ને આને તેમના એક સંખ્યાઓ સાથે તેઓ મારી મુલાકાતે આવ્યાં હતા. તેમને તેમના કૃત્ય બદ્લ પસ્તાવો પણ થતો હતો. એટલું જ નહિ, તેઓ પોતાના અસલ પતિ પાસે પાણી જવા માગતો હતો. તેમની માગણી-વિનંતી હતી કે તેમનો પતિ તેમને અપનાવી દે.

મેં તેમને સામે પ્રશ્ન કર્યો: ‘બહેન, તમે ઈરી પાણી પતિને છોડી ન હો એની શી આતરી?’  
તેઓ હંઈ જવાબ ન આપી શક્યાં. મેં તેમને માતાજીની છ્યાં ને મંત્રકાર્ડ આપ્યાં. દરોજ જાયત્રી મંત્રની ત્રણ માળા કરવા કહ્યું અને છ અહિના પછી પાણી મળવા જણ્યાંન્યું.  
હું તો હંમેશ કહેતો આવ્યો છું કે મન, વચ્ચન ને કર્મથી પવિત્ર રહી માતાજીની શરણાગતિ સ્વીકારો...’

શુરુહેવે પ્રેસંગ વર્ષાંબ્યા પછી વ્યક્તા કરેલાં કેટલાં મનતથ્યેને સંકલિત કરી અતે વ્યક્તા કરવાનો ઉપકુમ સ્વીકાર્યો છે. શુરુહેવના મિતાક્ષરી વક્તાબ્યને તેમની જ પ્રેરણાથી વિશ્વાસ કરીને અતે રજૂ કરવાનો આ પ્રયાસ છે.

અતે શુરુહેવે પૂછેલો પ્રશ્ન અને માળા કરવાનો આપેલો આદેશ આમ તો બધી સીધી સાદી તે સરળ વાત લાગે છે, પણ સરવાળે તો નજીર વાસ્તવિકાને, હકીકતોને જ વ્યક્તા કરી હો છે.

શુરુહેવે પૂછેલા પ્રશ્નમાં તે બહેનના કૃત્ય બદ્લ નારાજગી રૂપણ્યપણે વતીય છે, એટલું જ નહિ, કર્મના બન્ધનમાં આ અસત, કર્મની એક કરી વધુ જીમેરાતો તેમને દુઃખ પણ થાય છે. પણ દરેકે કરેલાં કર્મો તો બોનેવર્વા જ પડે છે. નિજની સત-અસત, કર્મો માટે માનવી પોતે જ જવાબદાર છે. એને કાઈ સન્ત, શુરુ કે સાક્ષાત ઈશ્વર પણ મિટોવી શકતો નથી.

અહિની પુવિત્ર સાક્ષીઓ, જનમોજનમના સાથી રહેવાનું એકમેકને વચ્ચન આપીને, તન, અન ને સર્વસ્વ એકમેકને અર્પણ કરી, એકમેકના પૂરક, પ્રેરક બનીને આરંભાયેલી દાપત્યજીવનની યાત્રા અધ્વર્યે બુદ્ધીને આમ અવળે માર્ગે ઇંટાય છે ત્યારે આર્થર્ય ને દુઃખ અને થાય છે. સમાજમાં રહીને આસપાસના વાતાવરણાથી પરિચય કેળવાતો સૌ સાથે હળીમળીને રહીએ તે જીવિત છે. પણ દાર્મપત્રનો વિચ્છેદ કરીને આમ પરમુદ્રા કે કી સાથે સંબંધ બાધવો ને તેમાં ય વળી બાળડોના માતા-પિતા અન્યા પછી? કેટલું બેહું લાગે છે! એવાં સ્વી-પુરુષોએ કરી વિચાર કર્યો છે અરો કે બાળડો પર તેની કરી અસર પડે છે? તેઓના જાવિ જીવન, ઈજાંબત, આખરુનું શું? પણ આ વધું વિચારવા-સમજવા કાઈ થોખતું નથી ને આધુનિકતાના અંચળા હેઠળ જીવન, સમાજ ને સંસારમાં આ ને આવી અનેક વિષમતાઓ - વિકળતાઓ આડાર પામતી રહે છે અને પછી જીવનની નિષ્ણિતતા - દુઃખનાં રોદણાં રડતો હું છે. નિરાશા-હતાશા આવે છે, જીવન એક જોગ બની જાય છે. પરન્તુ આ વધાના મૂળમાં અતુઘ્યની શુદ્ધિ, તેનો વિચાર જ તેને આમ આચાર કરવા પ્રેર છે.

જીવનની - કેળળ કૌતિક જીવનની સાહિત્યા - સિધરતા માટે પણ જીવચ વિચાર ને શુદ્ધ શુદ્ધિથી પ્રેરયેલ જાયપર જરૂરી તો છે જ. મનુષ્યના મનમાં અનેક પ્રકારની વાસનાઓના વિકારો ભરેલા પડેલા છે. જાણુનાના એ વિકારોને દૂર કરવા, મનની સિધરતા માટે, મનમાં જીવચ વિચારાને પેદા કરવા, પણ

આદ્યાત્મિક, કેઢી, જાન્યુઆરી, '૮૮ ]

મહાતું રમરણ ને મંત્રજ્યપ, આવશ્યક ને અનિવાર્ય બની રહે છે. મહાતું રમરણ ને મંત્રજ્યપ, ઈચ્છારની કરણાંતિ માનવીના કુત્સિત સંકારાનું વિરેચન કરી સદ્ગુર્દિ અર્પે છે. તેના વિચારા સાત્ત્વિક-ઉચ્ચય બને છે ને તે જીવનમાં આ ને આવી અધિમ, ભૂલભરેલા, અનીતિમય ને અપ્રમાણિક કૃત્ય કરતાં અચકાય કે હે જૈનાથી દૂર રહે છે.

જીવનની સફળતા માટે, જીવનની સ્થિરતા માટે પણ સાત્ત્વિક આદાર, આચારવિચાર જરૂરી છે. કારણ અનુભૂતિ તેવો એડાકાર એ ઉક્તિ અનુસાર સાત્ત્વિક આદાર મનમાં ઉચ્ચય વિચાર જરૂરી વાવે છે. ને ઉચ્ચય વિચારનો આચાર પણ ઉચ્ચય, પ્રમાણિક, ઉમદા ને ઉદ્ઘાત કરવે છે. જેના જીવનમાં નીતિ, પ્રમાણિકતા ને પવિત્રતા છે તેનું જીવન અવશ્ય સરળ ને સફળ બને છે. તે પ્રગતિને પન્થે પ્રયાણ કરે છે. અન્યથા માનવી અધોગતિને પન્થે, નિષ્ઠળતાના કારાગારમાં જ સખ્તિયા કરે છે. એને ડોર્ઝ જ અચાન્કી ન શકે.

અહીં મનની સ્થિરતાનો ઉદ્દેશ કરીએ છીએ ત્યારે ગુરુદેવે વર્ણવેલ ભીજે પણ એક પ્રસંગ ખાદ આને છે. ગુરુદેવની સુલાઙ્કાત દરમિયાન એક સુલાઙ્કાતી ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે મારું મન સ્થિર નથી થતું, મારું ચિત્ત એકાદ નથી થતું, તો શું કરું?

ગુરુદેવે તેમને પ્રશ્નુતર આપતો જણાવેલું કે ‘ભાઈ, પાણીને ડોર્ઝ આદાર નથી, પણ એ પ્રાણીને જેવા પાત્રમાં લઈએ તેવા તે આદાર ધારણ કરે છે. મનનું - ચિત્તનું પણ એવું જ છે. મેં ભાર્યા પુરત્થીમાં ને ‘આધ્યાત્મિક ડેડી’ના એ અંગે પ્રસંગોપાત ઉદ્દેશ કરેલો જ છે. હું એટલું કહીશ કે મનને ડેળવું પડે છે. પણ પ્રયત્નથી એ આવી જાય છે.’

મન સ્થિર કરવું, ચિત્તની એકાદતા કેળવવી એ ધર્મ દુઃખર કાર્ય છે. એને જેમ વિદ્ધાર કરવા હૈન, તેમ તે વિદ્ધાર કરે છે. પણ મનમાં ઉદ્દ્દુક્તા, ચિત્તમાં ચાલતા વિચારને નિયંત્રિત કરવાનો, એ વિચારાભાની શાંત થવાનો ને મનના સંદર્ભના વ્યાપારાને પ્રલુના - માતાજીના રમરણ, જ્યપ ને ધ્યાનમાં લીન કરવાનો થાડો પણ પ્રયત્ન કરવામાં આવે, સંજગ રહેવામાં આવે તો મન સ્થિર થઈ શકે છે, ચિત્ત એકાદ બની શકે છે. ડોર્ઝ પણ કાર્યને પરિપૂર્ણ કરવા માટે પુરુષાર્થ - નાના કે મોટા - કરવો જ પડે છે. તે જ પ્રમાણે ચિત્તની એકાદતા માટે પણ પુરુષાર્થ જરૂરી છે. અનુભવ કરી જોજે.

મનની સ્થિરતા, ચિત્તની એકાદતા તો લૌલિક એને આધ્યાત્મિક અને રીતે ઉપધ્યાત્રાને આવકારદાયક છે. તો જ ભાષ્યસ સ્વસ્થતાથી, શાંતિથી ને આનન્દથી જીવી શકે છે. ઉપાસનાના કભને સરળ બનાવી શકે છે. જીવન, સંસાર ને સમાજની ડોર્ઝ પણ પ્રકારની પળોજણોમાં અટવાયા વિના માનવીએ જીવનને સ્વસ્થ બનાવવાનો ને નિષ્ણલનન્દમાં મરત રહેવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. કદાચ નિષ્ણલ એ જ ભાષ્યસની મોટી ને શાશ્વત સંપત્તિ છે.

સંસાર અને સમાજની વચની રહીને જીવન જીવવાનો અને ઉપાસના કરવાનો - આધ્યાત્મિક ભાર્યા જીવાનો અભિગમ આપ તો ધર્મા દુઃખર ને કપરો છે. એ દુઃખર ને કપરા અભિગમનો માર્ગ ડેવી રીતે કરીન્ન કરવો તે અંગેનું માર્ગદર્શન પૂ. ગુરુદેવના સાનિધ્યની પળોમાંથી અલ્યા કરે છે.

સીધી લીટીએ પ્રલુપરાયણ ને સેવાભાવી જીવન જીવતાં લોકોની કેટલાંક સામાજિક પરિખણ કનાંદાત કરતી હોય છે, રીકા કરતાં હોય છે. જે કોકાંતને પોતાની સાથે ડોર્ઝ જ નિરખત નથી તેવી શાતાને અંગે સમાજમાં થતી વાતોથી સરળ માનવીને ખૂબ એદું થાય છે. એક હિસ્સ પૂ. ગુરુદેવના સાનિધ્યમાં કેટલાંક જણ એની જ વાત કરી રહ્યા હતા. ત્યારે ભીજ કેટલાંક તેવાઓની સાથે રપણતા કરી લેવી જોઈએ એવું મન્ત્રભ્ય વ્યક્ત કરતાં હોય અત્યાર સુધી શ્રોતા આવે બંધું સાંભળી રહેલા ગુરુદેવ

કંગવેથી છતો મજૂમતાથી કલ્યાણ : 'આપણે કશી માયાકુટમાં પહુંચ નહિ. આપણે આપણી ભરતીમાં નિઝનનનમાં ભરત રહેવું.'

બ્યક્તિ કે ઉપાસક સન્માર્ગે હોય તો લોકોની પરવા કરવાની જરૂર નથી.

આ નાનકડા વાક્યમાં ગુરુદેવ કેટલી સરસ વાત રજૂ કરી હે છે ! જીવનનો એક રૂપણ અભિગમ આમાંથી બ્યક્ત થયા વિના રહેતો નથી.

આપણે ગુરુદેવ પાસેથી આ જ શીખવાનું ને અમલમાં મૂકવાનું છે.

જેમણે પોતાના સધળા વ્યાપારો એક ભાત્ર પરમતત્વમાં - ભાતાજીમાં જોઈ દીધા છે તેવા સંતોને અને શાશ્વતજીને પણ આવી કુલ્લક વાતોમાં રસ ન પડે તે સ્વાભાવિક છે. તેઓ તેમાંથી અથવાનો અને ભાતાજીમાં જ લીન થવાનો, એકાય રહેવાનો અનુરોધ કરે તે સમજું શકાય તેમ છે,

તેમના આ શષ્ઠીમાં જીવન જીવનાના અભિગમ ઉપરાત ભક્તિ કે ઉપાસના શું છે કે, ભક્તિ કે ઉપાસના કરનારે સમાજ ને સંસાર પ્રત્યે કેવું વલણ ફરજવાનું તેનો નિર્દેશ પણ તરી આવે છે. આપણે સમાજની વચ્ચે જ રહેવાનું છે, સંસારનો સ્થાગ કે સમાજનો બહિષ્કાર આપણે માટે શક્ય જ નથી, એ હચિત પણ નથી. તેથી સંસાર ને સમાજની વચ્ચે રહી આત્મવિકાસ કે આત્મસાક્ષાત્કારને ભાગે જરૂરું હોય તો કરો. અભિગમ અપનાવવો જોઈએ તે અને પૂ. ગુરુદેવના પ્રસ્તુત શષ્ઠીમાંથી તરી આવે છે. સમાજ ને સંસારની વચ્ચે રહીને જેમણે પોતાના અવલોકનથી જે અભિગમ કંડાયો છે તે તેઓ આપણી જૌ સમક્ષ બ્યક્ત કરી રહ્યા છે.

આપણી વિદુદ્ધ, જે બાબતનું કે કંડીકતનું કોઈ અસ્તિત્વ જ નથી તે લોકમુખે જાંબળાને ભાનવીને સહેને જ દુઃખ થાય, પણ ગુરુદેવના આ શષ્ઠી તે દુઃખની પળોમાં સાન્ત્વન આપો નવી હિંદ્બા જીંધી રહે છે.

આપણે આપણા મનથી કે પૂ. ગુરુદેવના સુચનથી, આહેશથી પ્રેરાઈને દૈનિક ઉપાસના જરૂર કરીએ છીએ. પૂ. ગુરુદેવના કલ્યા મુખ્ય કે આપણી અનુદૂણતા પ્રમાણે ત્રણ, પાચ, સાત કે અગ્નિયાર ભાળા અને સ્તોત્રપાઠ વગેરેને આપણે દૈનિક ઉપાસનાના કર્મમાં સમાવી લઈએ છીએ અને ભક્તિ કર્પનો સંતોષ અનુભવીએ છીએ. પળ-શ્રી-પળ માટે આપણા હિંદુમાં શ્રદ્ધા ને શરણાગતિનો આવ ઉદ્ઘાસ્યો ન ઉદ્ઘાસ્યો. ત્યા તો વિરમી જાય છે. શ્રદ્ધા ને શરણાગતિ શું છે તે આપણે પૂરૈપુરુષ સમજ જાહેતાં નથી. પરમાત્માનો - ભાતાજીનો. આપણું ને ડોઈ ભાસ અનુભવ કે પરિચય નથી. મોઢેથી કે મનથી તેને યાદ કરીએ છીએ પણ અંતરમાં - અસ્તિત્વમાં તેની વ્યાપકતાની સથન અનુભૂતિ કે આનન્દ થતાં નથી. આપણું ચિત્ત તેનામાં પૂર્ણપણે એકાય નથી થતું; પરિચયે આપણા રોજખરોજના વધા જ વ્યવહારેમાં ઉદ્ઘબત્તી આ ને આવી અનેક નાની-મેટી સમર્થા - પળાજણા - આડખીલીએ આપણું અંકળાવી શું છે. આપણી આ અંકળાભય વગેરે બાબતો જ આપણું પરમતત્વ શું છે, શ્રદ્ધા-શરણાગતિ શું છે, ભક્તિ-ઉપાસના શું છે, તેને અમન્ત આનન્દ કરો. હોય છે તેની અનુભૂતિ કરવા હેતી નથી. એ અનુભૂતિના અભાવને કારણે અસ્તિત્વને એ અલોકિક આનન્દનો સંસ્પર્શ થતો નથી કે થવા હેતો નથી. અર્થાત્, આપણે નિઝનનની લાગણી અનુભવી શકતા નથી. નિઝનનનમાં અસ્તિત્વને તરફેણ કરી હેવા પૂ. ગુરુદેવના આ શષ્ઠી સતત સમરથુમાં રાખવા જરૂરી લાગે છે. ભરતી વિનાનું જીવન એ જીવન નથી. ભક્તિ એ ભક્તિ નથી ને હોય તો પણ તે એક એકરૂપ લાગે છે. તન, મન ને જીવનની હળવાળા સહણતા માટે નિઝનનની લાગણી જન્માવવાનો પ્રથતન ચાલુ રાખવો જોઈએ એમ લાગે છે. અનુભવ કરી જાનો.



## ભક્તિનો સહ્યોગ

એ

તરમાં ડાઈ પણ પાક ઊગાડવા માટે જેમ જમીનમાં બી રોપવા પડે છે, તે જ રીતે પરમતત્ત્વની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ નિજના મનોલેતમાં અદ્ધાના બી. શી પ્રથમ રોપવા પડે છે, એ આવશ્યક ને અનિવાર્ય બની જય છે. એતરમાં જેમ બી વાવવાથી જગમ ખેતર મોલથી લહેરાતું થઈ જય છે તેમ હસ્તપદ પર પ્રભુ પ્રત્યેની અદ્ધાનાં બી વાવવાથી, પ્રભુના કૃપા-આધ્યાત્મિક-પ્રેરણનો પરિપાક પ્રાપ્ત થાય છે.

વ્યક્તિના અરિતત્વમાં જર્યા સુધી અદ્ધાનો આવિજ્ઞાવ નથી થતો તર્ફા સુધી તેનામાં શરણાગતિનો લાવ પણ ઉદ્ભાવતો નથી. અદ્ધા અને શરણાગતિ વિના કરવામાં આવતી કઠોર તપશ્ચર્યા - અનન્ત ઉપાસનાનો - નિરંતર જર્યનો - નામરમરણનો ડાઈજ પ્રતિભાવ સાંપડતો નથી. અદ્ધા વિનાતી ઉપાસના નરી એક રથૂળ પ્રક્રિયા બની જય છે. ઈશ્વર સાથે - માતાજી સાથે - પોતાના ડાઈ પણ છાય હેવ સાથે માનસિક અનુસંધાન સાધી શકાતું નથી. ભગવાન ને લક્ષ્ણનો નાતો જેડાતો નથી ને તેથી વ્યક્તિની તપશ્ચર્યા - ઉપાસના ભગવાન સુધી - માતાજી સુધી પહોંચી શકતી નથી. આને પરિણામે આપણે જૌતિક કે આધ્યાત્મિક ડાઈજ સફળતા - સરળતા પ્રાપ્ત કરી શકતા નથી ને નાહકના ઈશ્વરના અરિતત્વને હોય હેવા સુધીની મૂર્ખતા આચરીએ છીએ ને ઉચ્ચિત નથી.

અદ્ધા અને શરણાગતિના ભાવને અરિતત્વમાં પ્રથમ બનાવીને પછી જ ઈશ્વર સમજ્ઞ - માતાજી સમજ્ઞ - છાય સમજ્ઞ ઉપરિથિત થવાની પાત્રતા પ્રાપ્ત કરી શકાય એમ કહું તો અનુચિત નહિ લાગે. ઈશ્વરનો - માતાજીનો અનુગ્રહ મેળવવા. તેની અનુભૂતિ કરવા માટે સૌ પ્રથમ આપણા - વ્યક્તિના અંતરમાં પણ તેને માટે અનુરોગ - અનુગ્રહ ઊગાડવાની - જગત કરવાની આવશ્યકતા છે. અનંતરમાં એવો અનુગ્રહ ઊગાડવાને અહૃતે - પરમતત્ત્વની શક્તિને - એ શક્તિને આત્મસાત્ કરી ચૂકેલા પરમાત્માના દૂતોની - સંતોની શક્તિને પડકારવામાં પણ વ્યક્તિની અદ્ધા જ વ્યક્ત થાય છે. એ અસીમ શક્તિનો ઓછાયે તો સર્વત્ર પથરાયેલો હોય છે. વ્યક્તિએ ફંડેલા પડકારમાથી પણ ઈશ્વરની ઈશ્વરના દૂત સમાન સંતોની પરમ કૃપાળું શક્તિનો વિરલ, અદ્ભુત ને અલોહિક અનુભવ થાય છે. એ અનુભવને આધારે વ્યક્તિમાં અદ્ધાનું, શરણાગતિનું, ઉપાસનાનું એક નૂતન કિરણ પ્રગટે છે, જેના ઊજસમાં વ્યક્તિ નિજના શૈથાયે - કલ્યાણથી કટિબધ્ધ બને છે.

અને ઉપરિથિત કરેલા પ્રસંગમાથી ઉપાસકોને કંઈક ને કંઈક પ્રેરણ પ્રાપ્ત થશે એવી આચા છે. સુક્ષમ અદ્ધાની સ્કુરણ્ણા કથારે ને હેવા સંલેઝોમાં માનવીને થાય છે તે વાતને વ્યક્ત કરતો પ્રસ્તુત પ્રસ્તુત રસપ્રદ લાગે છે.

સુરત જિલ્લાના નવાગામ - સોનગઢના શ્રી ડાકોરખાઈ નાયક લખી જણાવે છે :

'સુરતમાં મેં શાલ્વીજીની સુલાકાત લીધી હતી. પણ તે સુલાકાતમાં મને સંતોષ થયો ન હતો. એક જ મિનિટમાં વારો ઘટમ, છતાં 'આધ્યાત્મિક કેડી', 'ઉપાસનાને પન્થે' તેમ જ અન્ય સાહિત્ય-અધ્યી ઉપાસનામાં માર્ગદર્શિન મેળવતો હતો.


હું ડાઈસ્કૂલમાં શિક્ષણ હતો. હવે નિવૃત થયો. હું અને ગાયત્રી માતાજીની સેવામાં મારી ધર્મ-પદ્ધતી સાથે લાગી ગયો હું.

॥ कुर्यात् सदा मंगलम् ॥



॥ श्री गणेशाय नमः ॥

लग्न निमंत्रण-प्रिया



ભરસી પડી છે કૂપા વેકનની કેરી  
આથી આશીષ ને ફરકાવી 'વિજય'-પતાકા  
આયો રહે અવસર મંગલ આંગળી  
હા, બાધાઈ રહ્યો છે માંડવો માંગણી  
ઝડી રહ્યા છે આસોપાલવ આરસાઓ  
દુલાઈ રહ્યા છે શરખુાદના સૂર  
આખ્યો ચેવાઈ માંડવે સાજન - માજન કાક  
ને દી રાંધી હાયે, પીઠી ચીઠી લાંડકડી  
અહી રહ્યી છે હસ્ત 'વિજય'નો,  
આપી રહ્યી છે વરમાળ કંઘતા કુ

પ્રીતના પાનેતરે છીઠી વિચરણ આંગળું  
પ્રજાનબદિત અન્નિ-ધૂમ્રસેરાની સાક્ષીમે  
સપાપદીનાં સૂત્રોએ કદ રહ્યાં છે બચન  
વિજય-મતા લોચબનાં થકને રહેવા.  
વરી રહ્યી છે લિવનસાથીને મિતા  
અહે ! નવપદ્મબિત થતું નંય લુધન !

આશિષ આપી માત કહે છે.  
પરણાંતુ છું લાડકી મિતાને.

આખને સૌ ભક્તાજને।  
દઉં છું નિમંત્ય મેમ કરી, જો એ હેતે કરી રહીકારને।

નરેન્દ્ર આપી દવે  
આ.સ્ટો. કુસુમ એન. દવે

॥ २० ॥ अस्ति विद्युता गुणां गुणां गुणां गुणां गुणां ॥ २१ ॥ अस्ति विद्युता गुणां गुणां गुणां गुणां गुणां ॥ २२ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २३ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २४ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २५ ॥


गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २६ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २७ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २८ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ २९ ॥

गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां गुणां ॥ ३० ॥



धियो यो नः प्रचोदयात् ॐ ॥

ॐ मुर्मुक रथः ॐ तत्सचिवत्वरेण्यम् भग्नो देवस्य धीमहि



ગાયત્રી માતાના અંહિરનો વિના બેતન પૂજાનું કામ સહાયું છે. દરરોજ પથાથકિન જ્યા કરું છું. અનુષ્ઠાન પણ કરું છું. આવણ સુઃ પરવાથી ચોવીસ લાખના પુરશ્રણુંની પણ શરૂઆત કરવાનો હતો. પણ એકદમ મુશ્કેલી આવી પડી. પુરશ્રણુંમાં એસતો પહેલા અંહિરનો હિસાન એંટિ કરાવી લઈ એવું નક્કી કર્યું, પણ ઇંડિયાનાની એ રસીદ્યુકો ગુમ થઈ ગઈ હું ચિંતાતુર થઈ ગયો. મારી માર્યાના નિષ્ઠળ જવા લાગી. રોજના પાંચ હજાર જ્યા ચાલુ કરી દીધા, પણ તે જ્યા વ્યર્થ જવા લાગ્યા.

મારા જીવનમાં માતાજીએ અનેક વખત મહા કરી છે, તે પ્રસંગે અને અરથાતે છે. પરતુ આ જ વખતે મારા જ્યા નિષ્ઠળ જવા લાગ્યા.

મારી ધર્મપત્ની ‘આશ્રિપતુ’ અમૃત ‘અને ‘ગાયત્રી જ્ઞાન અને ભદ્રિમા’ વાંચી રહ્યા હતાં. તેણે અને હું કે આપણે શાસ્ત્રીજીને મળ્યાએ. પણ શાસ્ત્રીજી પ્રત્યેની મારી શ્રદ્ધા એછી એટલે મેં હું કે એમારી શાસ્ત્રીજી શું કરવાના? આપણા જ ડોર્ઢ કર્મો આડે આવ્યાં લાગે છે, એટલે કર્મભાથી તો શાસ્ત્રીજી કેની રીતે છેડાને?

શાસ્ત્રીજી પ્રત્યે મારી ધર્મપત્નીની શ્રદ્ધા અપાર એટલે વારંવાર એક જ વાત મારા ભાથા ઉપર ભારવા માંડી કે આપણે શાસ્ત્રીજીને મળ્યાએ. મેં ગુરુસામાં કંદી દીધું કે શાસ્ત્રીજી સાચા હોય તો એ દિવસમાં બુક મળી જય તો આપણે અવરય દર્શાને જરૂરી. મારી પત્નીને પણ શ્રદ્ધા એસી ગર્દ કે શાસ્ત્રીજીના પ્રતાપે ચોક્કસ બુક મળી જશે અને બીજે દિવસે જ ચમત્કારિક રીતે બુક મળી ગઈ. મારી એક લારે આફાત ટળી ગઈ. ગાયત્રી માતા પોતાના ભક્તાનું કામ જરૂર કરે છે એની આતરી થઈ. મારી જક્કિના, અપૂર્ણ હતી. શાસ્ત્રીજી ની જક્કિના સહયોગથી આ કામ થયું.

પુ. શુરુદેવ શાસ્ત્રીજી ઉપાસના માટે શ્રદ્ધા અને શરણુગતિ પર વિશેષ લાર શા માટે મૂકે છે તેનું કારણ પણ આ નાનકડો પ્રેસંગ સમજની જય છે. વ્યક્તિમાર્ય પળભર માટે પણ જે માતાજી માટે શ્રદ્ધા અને શરણુગતિ ઉદ્દેશે, વ્યક્તિ જેનું ભાર્ગદર્શન લેવા જય છે તેનામાં પણ તેને જે શ્રદ્ધા-વિશ્વાસ હોય તો જ તેનું કાર્ય આમ સિદ્ધ ચાય છે, સરળ બને છે. તો એને આધારે આપણે જો એટલો જ વિચાર કરીએ કે શુરુદેવ કેવી પ્રયત્ન અને પ્રભર શ્રદ્ધા અને શરણુગતિના આશ્રે આક્ષાત્કાર કર્યો હશે! આપણા સૌમા પણ એવી પ્રયત્ન ને પ્રભર શ્રદ્ધા અને શરણુગતિ ઉદ્દેશે એવી અભ્યર્થના કર્યો સિવાય બીજો ડોર્ઢ આરો ઉપાસના માટે નથી હેખાતો.

ચુશ્ચરની - માતાજીની શક્તિ પારાવાર છે. તેની સહાય ગેણી છે. સહાય માગનારને મળે જ છે, પણ જરૂર છે વિનઅતાની - શરણુગતિની - શ્રદ્ધાની. □

‘ગુરુકૃપા હિ ડેવલમ’

મીના ટ્રેડસ

“ભ ગ વ તી”



ઉદ્વાદા-Rs. 3૬૬૧૮૫

# ખોવાયેલ દાગીનો પાછો મહુયો !

**રમેશ** પણે ત્યા ધર્ષી વાર એવું બને છે કે સોનાના દાગીના જેવી ક્રિંમતી વસ્તુ ધરમાને ધરમાં જ, એક જગાએથી ભીજુ જગાએ, એક કલાટમાંથી ભીજુ કલાટમાં, કચ્છાંક આડે-અવળે હાથે મૂડી હેવાય છે ને પછી આપણુને જ એનો ખ્યાલ નથી રહેતો. એ ચીજુ-વસ્તુ કચ્છાં મૂડી છે તે આપણે ભૂલી જઈએ છીએ, ને પછી આજું ધર ફેંદી વળાએ છીએ પણ તે ખોવાયેલી વસ્તુ અળતી નથી. દાગીનો ચોરાઈ ગયાની ભાતિ ઘેરી વળે છે, દ્વારાડો પડે છે અને હલરો ઇસ્થિયાની વસ્તુ માટે માનવી હુઃખી થાય એ સ્વાભાવિક પણ છે.

અગવાન તો લક્ષ્ણના નાના-નાના કાર્યો કરવા પણ તત્પર હોય છે. આવી નાનુક પળોમાં વસ્તુઓ અંગે થયેલી વરેસ્મંતિ દૂર કરી, તેની સ્મરિતિને સતેજ અનાવી જે તે વસ્તુએ. કચ્છાં મૂડી છે તે ધાર હેવડાને છે. એ યાદને સહારે ખોવાયેલી ગણ્યાતી સોનાના દાગીના જેવી ક્રિંમતી ચીજુવસ્તુએ ભળા આવે છે ત્યારે તે ખૂબ આનંદ ને રાહત અનુભવે છે.

અને આવો જ પ્રસંગ પ્રસ્તુત કરો છે :

૧૯૮૭ના ઓગસ્ટમાં લંડનમાં શુરુહેવનો વ્યક્તિગત મુલાકાતનો કાર્યક્રમ હતો. મુલાકાતીઓની કૃતાર્મા જિલ્લાં રમાયેન તેમનો વારા આવતાં શુરુહેવ પાસે ગયા. તેમણે શુરુહેવને કહ્યું : ‘શુરુહેવ, મારા ધરમાંથી, મારી વહુનો સોનાનો દાગીનો ગુમ થઈ ગયો છે. શું કરું ?’

શુરુહેવ કહ્યું : ‘હું કાશિષ કરીશ, મળો જશો.’

શુરુહેવ તો આલું કદી લંડનનો સમય કાર્યક્રમ પતાવી અમદાવાદ આવી પહોંચ્યા હતો. રમાયનને શુરુહેવના શાહીમાં સર્વપૂર્ણ શ્રદ્ધા હતી, એ શ્રદ્ધા ને વિશ્વાસ સાથે તેઓ પાર્શ્વ ઇઝાં હતાં અને એને પરિણામે તેમનો દાગીનો મળ ગયો. દાગીનો અળતી આનંદમાં આવી જઈ, ઇતિહાસની લાગણી વ્યક્ત કરતાં રમાયને લંડનથી પત્ર પાડ્યો. હતો. એ પત્રમાં તેમણે જણાયું હતું હે મેં મૂરી શ્રદ્ધા રાખી હતી. માતાજીની દ્વારા શુરુહેવની વહુનો દાગીનો ધરમાંથી મળી ગયો છે. નિપદ્ધ ગાયત્રી મા સદ્ગુરૂની રક્ષા કરો.



મા જાયત્રીની કૃપા

શ્રી ગણેશ ટ્રેડસ್

‘ભ ગ વ તી’



ઉદ્વાડા-Rs. ૩૬૬૧૮૫



## બ્રેઇન હેમરેજ માંથી મુક્તિ !

**હુદ્દિનાં હુઃખ્દોં વ્યક્તિનાં પોતાનાં જ કોઈં ઇણ હોય છે.** પરમાત્માની - માતાજીની -  
પોતાના ધાર્યા હેવની શ્રદ્ધાપૂર્વક જરૂરાગતિ સ્વીકાર્યા વિના, તેની ઉપાસના કર્યા વિના  
ત હુઃખ્દોંનો અન્ત આવતો નથી. આજની વિદ્યાનની અલ્પતન શોધના જમાનામાં પણ ભાનવી  
અનેકવિધ દર્દીઓ પીડાતો રહે છે. એવાં દર્દીની સારવાર પરદેશમાં કરાવવા ધર્યાં સંપન્ન લોડો જાય  
પણ છે. જેઓ ત્યાં જ જર્દને વસ્યાં છે તેઓ તો સ્વાભાવિક રીતે જ એવી સારવારથી વંચિત ન  
રહે. તેમ છતાં એવી સારવારતું પરિષ્યામ સંતોષકારક ને લાભદાયક ન નીવડે ત્યારે ?

શુરુહેવની વ્યક્તિગત મુલાકાત દરમિયાન મુલાકાતીઓ જીવનની અનેકવિધ સમસ્યાઓના સળગતા  
પ્રશ્નો જર્દને તેના સુલજાવ મારે આવે છે. અનેકવિધ શારીરિક દર્દીમાંથી મુક્તિ મેળવવા શુરુહેવના  
માર્ગદર્શન - આશીર્વાદ મારે આવે છે તે સર્વને શુરુહેવ માતાજી ને હોઈ સંકેત કે પ્રેરણ મળે  
તે મુજબ માર્ગદર્શન આપે છે, પણ એટં જે પરિષ્યામ આવે છે તે એકદમ આશ્રયચક્રિત કરી હે  
તેનું અલૌકિક હોય છે, એટલું જ નહિ, શુરુહેવનાં કાર્ય ને માતાજીની અલૌકિક અગ્રણ્ય શક્તિ વિશે  
નિરભય ને કુતુહલ પણ મનમાં પેઢા કરે છે. તેનો વિચાર માત્ર પણ અંતરને પુલકિત કરી હે છે !

લિખિંગસ્ટનના એક ભાઈને બ્રેઇન હેમરેજ થયું હતું. ચાર મહિના સુધી તો તેઓ કશું જ  
નોઈ શકતા નહોતા. જેમણી બાળુના જરૂરાતું હાડકું હાલતું હતું, ડોક્ટરે ઓપરેશન કરવા જરૂરાંય  
હતું. તે વખતે શુરુહેવનો લિખિંગસ્ટનમાં કાર્યક્રમ હતો. તેમની હકીકિત શુરુહેવને જરૂરાવવામાં આવી ત્યારે  
શુરુહેવ તેમને ગાયત્રી-મંત્રની જરૂર માળા કરવા જરૂરાંયું, જીવનજળ આર્થિયું ને સાથે કાળી દ્રાક્ષ લેવા  
જરૂરાંયું. શુરુહેવના આ માર્ગદર્શનનો અમલ કર્યા પછી એ મહિને ડોક્ટરને જતાવતો ડોક્ટરની  
તપસસમાં જરૂરાંયું કે જે હાડકું હાલતું હતું તે શીટ થતું જરૂરાતું હતું. ધીમે ધીમે સુધારો યના ભાડાઓ  
ને જ મહિનામાં એકદમ સારું થર્ડ ગયું. તેઓ સારી રીતે જોઈ શકવા લાગ્યા. સાત-અ ઠ કલાકના  
ઓપરેશનમાંથી મુક્તિ મળો ને કમસો એકદમ સારું થર્ડ ગયું.



મુખુદ્વારના આશીર્વાદની અદ્યાર્થના સહિત

**આરતી ટ્રેડસ್**

**જનરલ મરયન્ટ**

**‘લ અ વ તી’**

કલાકા - Rs. 361184

## શાળગોપિદ

**પ્ર૦ :** ગુરુહેવ, હું ઈશ્વરમાં માનું છું, આસ્તિક છું કે આધ્યાત્મિક માર્ગે જાઉં છું એમ કરવું એ અહંકાર છે?

**ઉ૦ :** આપણે જે માર્ગ રલ્યા છીએ તેનો નિર્ણય કરવાથી અહંકાર થતો નથી. એને હું અહંકાર ગણુંતો નથી. પરન્તુ મેં આ કર્યું, હું કરું છું, મારા વડે જ થાય છે એમ માનવાથી અહંકાર જરૂર ગણાય છે.

**પ્ર૦ :** અહંકાર એકદમ સ્ક્રમ છે. એને ઓળખી શાશવાય ખરો?

**ઉ૦ :** કેમ ન ઓળખાય? માણસની ચાલ પરથી અહંકાર ઓળખાય છે.

**પ્ર૦ :** વ્યક્તિ પોતે પોતાનો અહંકાર કેવી રીતે ઓળખી શકે?

**ઉ૦ :** અહંકારને ઓળખવા માટે દરરોજ રાતે સ્ત્રી વખતે દસ મિનિટ વ્યક્તિએ પોતે પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આજે આખા દિવસ દરમિયાન મેં શું શું કાર્ય કર્યું, કેવી રીતે કર્યું, કાની સાથે કેવી રીતે વાત કરી, એમ પોતાનાં સધળાં કાર્યોની મૂલ્યવાટી વ્યક્તિએ જાતે જ કર્યા જોઈએ. તેણે સ્વયં objective બનવું પડે. Self evaluation - સર્વ-મૂલ્યાંકનની ટેવ પાડવામાં જાવે તો જરૂર વ્યક્તિ પોતે પોતાનો અહંકાર ઓળખી શકે. એક ભહિનામાં તો એમ કરવાથી પ્રાવરસા થઈ જવાય. વ્યક્તિ અનેક પડળાથી વેરાયેલો હોય છે, વિનેકશન્ય હોય છે, પણ દરરોજ રાતે સ્ત્રી વખતે પ્રાર્થના કરવાથી ને જાતને મૂલ્યવાનો પ્રયાસ કરવાથી વ્યક્તિમાં પોતાનામાં રહેલા અહંકારની દર્શાન કરી શકે છે, એને દૂર કરવા પ્રયાસ કરી શકે છે ને તેનામાં વિનાતા-વિનય-વિવેક પ્રગતે છે.

**પ્ર૦ :** અલમુહૂર્તમાં ઉપાસના ચાલુ રાખવા કયો પુરુષાર્થ જરૂરી છે?

**ઉ૦ :** અલમુહૂર્તમાં ઉપાસના કરવા એને ચાલુ રાખવા વહેલા જિઠવાની ટેવ પાડવી જોઈએ. વહેલા જિઠવા માટે દરરોજ રાતે વહેલા સુઈ જવાનો નિયમ કરવો જોઈએ. એ માટે વ્યક્તિએ પોતાની જાતને જ કર્ણવાની જોઈએ, તૈયાર કરવી જોઈએ. વ્યક્તિના-ઉપાસકના દિલમા સચોટ પ્રેમ, લગની ને તત્પરતા હસે તો અલમુહૂર્તમાં ઉપાસનામાં બેસવાની અગ્રણ નહિ પડે. એ અન્ય નહિ થાય. એ પ્રમાણે ટેવાર્ધ ગયા પછી ઓલાર્નિ પણ જરૂર નહિ પડે. તમે રાતે બાર વાગ્યે સ્ત્રીઓ હસો તો પણ ત્રણ-સવા ત્રણે અચૂક જિઠી જર્દ શકરો.

**પ્ર૦ :** ગુરુહેવ, પણ મારો અનુભવ તો એવો છે કે રાતે ગમે તેટલા વહેલા સુઈ ગર્દી હોઈએ તો ય, નિશ્ચય કર્યો હોય તો પણ આંખ ને મગજ પર જિંધનું એવું બારણ લાગે છે કે જિઠી જ નથી શાશ્વત. એ માટે શું કરવું?

૩૦ : એ તમારી આગસ ને નિર્ભળતા છે. તમે તમારી જાતને જ કહોવો.

૪૦ : કથારેક ઉપાસનાનો સમય સાચવી નથી શકાતો કે સંજોગવશાતું એ સમય ઓછો કરવો પડે છે તો તે યાકી શકે?

૩૦ : હૈનેક ઉપાસનામાં વહેલું મોકું થાય કે ઓછો-વધતો સમય હોય તો ચાલી શકે છે પણ બાકી રહે એટલું માનસિક તો કરી જ લેવું જોઈ એ. અનુષ્ઠાન વખતે ચોક્કસ સમય જગતવો જ જોઈ એ.

૫૦ : પરનિન્દા એટલે શું? તે કથારે બન્ધનકર્તા નિવડે?

૩૦ : કોઈ પણ વ્યક્તિની બાબતમાં જે હકીકત વાસનવર્મા છે જ, કે તેમ બની ગયું છે જ, તે કહેવામાં નિન્દા નથી પણ જે હકીકતતું અસ્તિત્વ જ નથી, જેનો કોઈ પાયો જ નથી, જેમાં કોઈ તર્થી જ નથી એવી વાતોને નિન્દા કહોય છે ને તે બન્ધનકર્તા નીવડે છે. કોઈની તૃદ્ય વિનાની અદનામી, કરવી તે નિન્દા છે.

૫૦ : દુઃખીના દ્વિતીના આસું સાચા છે કે બોટા તે ડેવી રીતે જણી શકાય?

૩૦ : આપણા પરિચયમાં જે વ્યક્તિઓ આવે છે તે સર્વની પરિસ્થિતિથી આપણે પૂરેપૂરા જણાકાર હોઈ એ જ છીએ. એવી વ્યક્તિઓનાં વિકટ-વિષમ પરિસ્થિતિમાં સદાતુભૂતિ-આશાસન-હમહદી-દ્વિલાસે આપવો એ માનવતાનું કાર્ય છે.

૫૦ : વ્યક્તિ સાચે જ નિઃસહાય છે તે ડેવી રીતે જણી શકાય?

૩૦ : જે વ્યક્તિ સહાયની વાચનાથી આપણી સામે આવે છે તેની નિઃસહાય દ્વારાની તપાસ કરી લેવી જરૂરી છે. તેની અસહાય દ્વારાની પ્રતીતિ થયા પછી તેને સહાય કરવી એ ઉદ્દાત ને ઉમદા કર્તાંય છે. નિઃસહાયને સહાય કરવાની વાત આવે છે લારે વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત - અન, કપડા, બાળકોની કી કે હવા - વગેરે માટેની આવશ્યકતા પૂરી પાડવી જોઈ એ. વ્યક્તિની નિઃસહાયતા-લાચારી જાણ્યા પણ પણ તેની ઉપેક્ષા કરી તે તરફ દુર્લભ સેવવામાં આવે તો તે કેટલે અંશે ચોંબ્ય છે?

૫૦ : ધ્યાન દરરોજ કરવું જરૂરી છે? કેટલા સમય સુધી ધ્યાન કરવું જોઈ એ?

૩૦ : ધ્યાન દરરોજ કરવાની આવશ્યકતા છે જ. ધ્યાન એ પણ ઉપાસનાનો એક ભાગ જ છે. જ્યાં ને ધ્યાન એકમેકની પૂરક છે તેથી દરરોજ ધ્યાન કરવાની ટેવ પાડવી જ જોઈ એ.

મેં ધ્યાન માટે દસ મિનિટોનો સમય કર્યો જ છે, પણ પ્રેક્ટિસ પડ્યા પછી અનુકૂળ હોય તે પ્રમાણે ધ્યાનનો સમય દસ મિનિટથી વધારી શકાય છે.

૫૦ : પ્રાણ્યાયામ કરવા જરૂરી છે?

૩૦ : પ્રાણ્યાયામ એ શ્વાસોન્ધિવાસની એક પ્રક્રિયા છે. ઉપાસના કરતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે છે પણ એ વધાને અનુકૂળ નહિ થાય. કોઈ વ્યક્તિ એ નહિ કરી શકે. જેને સુજ હોય, આવડત હોય ને પ્રેસ્ટિસ હોય તે કરે તો વધી નથી. ઉપાસનામાં ધણી અધી બાબતનો સમાવેશ થાય છે ને તે બધું સામાન્ય ઉપાસક માટે સરળ ને શકાય નથી. હું સરળ રાહનો નિર્દેશ કરું છું એટલે તેમાં અધી જ જાતની સરળતા આવી જાય છે. નાતામાં નાનો છાડરો પણ તે કરી શકે એવી સરળ ઉપાસના હેઠલી જોઈ એ. મેં પહેલેથી જ વિધિવિધાનને પ્રાધાન્ય ન આપવાનું કર્યું છે એટલે

આધ્યાત્મિક કેડી, જાન્યુઆરી, '૮૮ ]

તેમાં બધી જ વિધિઓ આવી જય છે જેમને અનામાસ ખાસોભજનાસ થઈ જતા હોય તે બલે થાય. પણ એ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રાણુધામ સામાન્ય ઉપાસક માટે અનિબાર્ય નથી.

૪૦ : ફેટલીકરવાર માળા બન્નવતું થાય છે, એકાગ્રતા - આનન્દનો અનુભવ નથી થતો. તો અતિશય કાર્યની પગામાં આકસ્મિકપણે જ ચિત્ત માતાજીના સમરણુમાં-જરૂરમાં લીન બનીને અલોકિક રૂપન્નો ને આનન્દનો અનુભવ કરે છે એનું શું કારણ?

૪૦ : સુષુપ્ત અવસ્થામાં આપણું મન જે તે કાર્યમાંથી હી જતું હોય છે. માળા કરતી વેળા મન ખીજ બાધ્યતા ચાલ્યું જય છે, તો અન્ય કાર્યની પગામાં મન જરૂર કરવા તત્પર થઈ ગિયે છે. એટલે મન બદકહું રહે છે. મનને રિથર કરવાની જરૂર છે. મનને રિથર કરવાનો - ચિત્તને એકાગ્ર કરવાનો સતત પ્રયત્ન કરવાનો છે, તેથી સતત મંત્રજરૂર કર્યા કરે. એ વખેંની સાધનાને અન્તે જરૂર, તરત નહિ જય.

૪૦ : સાચી તપસ્યા કોને કહેવાય?

૪૦ : તપસ્યા એટલે માનવીમાં રહેલી ચૈતન્ય - પ્રાણુશક્તિનો વિકાસ કરવો. તપશ્ચર્યા કરવાથી માનવીમાં રહેલી જીર્ણ શક્તિનો વિકાસ થાય છે ને તે ગતિશીલ બને છે. એ ચૈતન્યશક્તિ વિકાસ થાય છે ને તે ગતિશીલ બને છે ત્યારે ઘણુરના દર્શન-જાંખી થાય છે, અલોકિક અનુભવનો થાય છે, સમસ્ત અસ્તિત્વ ધ્યાનની સાથે તદ્દાકારતાની અનુભૂતિ કરે છે ને એમ કમશા: તે આત્મસાક્ષાત્કાર સુધી જરૂર પહોંચે છે-પહોંચી શકે છે, ને કયારેક જે કે ન પહોંચે એવું યે બને કારણ કે આધ્યાત્મિકતા ઉપાસનાનું સ્થેત્ર અલોકિક ને અગ્રભૂત છે. ઘણુરની લીલા અફલ છે ને માનવીના કર્મો પણ એમાં મહારવનો ભાગ ભજવે છે.

ગમે તેમ પણ માનવી એક યા અન્ય રીતે તપતો જ હોય છે. જે જે પરિણમો - ભૌતિક કે આધ્યાત્મિક - કષ્ટદાયક બને તેમાંથી પાર જીતરી શક્તિ ને શરણાગતિના ભાવને ખંડિત થયા વિના જીવન ને ઉપાસના ચાલુ રાખવાની ક્ષમતા-શક્તિ કેળવણી તે તપશ્ચર્યા કહેવાય છે. જીવનમાં અને ઉપાસનામાં માનવી અનેકવિધ રીતે તપતો હોય છે ને સફળતા-સિદ્ધિ-સરળતા પામે છે. એ પાખવાની સમસ્ત પ્રક્રિયા તપસ્યા જ છે.

પરન્તુ આપણે તપસ્યાને બહુ સીમિત અર્થમાં લઈ લીધી છે. તપ એટલે દેહભન કરી શરીરને સુકળી નાખવું, શારીરિક શક્તિ ક્ષીણું કરી દેવી એ તપસ્યા છે. મૂળભૂત રીતે તો શક્તિ ક્ષીણું કરવાની નહિ, પણ ક્ષમતા-શક્તિ પ્રાપ્ત કરવાની સધળી આત્મરક્ષિયાએ તપસ્યા જ બની જય છે. જે વ્યવહારથી કે આચરણુથી આપણી શક્તિ ક્ષીણું થઈ જય તે વ્યવહાર કે તે ભાર્ગ ધાર્મિક કે તપસ્યાનો ન ગણી શકાય. એ કોઈ રીતે આવકારદાયક પણ નથી.

એ બધી તમામ પ્રક્રિયાઓમાં લેમ જ ધ્યાનાના નામસમરણ, જરૂર કે રટણુમાં અંતરનો જોડો પ્રેમ, ભાવના, તાદીન્ય ન સધાય ને ન ઉદ્ઘબ્બવે લાં સુધી એનો કોઈ અર્થ નથી. એ વિનાની તપસ્યા કોરી જ બની રહે છે, યંત્રવતું બની જય છે. એક બાઈએ સંકલ્પ કર્યો હતો કે મારું અસુક કાર્ય થશે તો હું લઘુ-અનુષ્ઠાન કરીશ. કાર્ય પૂરું થત૊ સંકલ્પ પૂર્તિ માટે તેમણે જુદ્ધિ લડાવી રખર સ્ટેમ્પથી ૨૪,૦૦૦ મંત્રજરૂર છાપી દીધા. આ ઉચિત ન કહેવાય. આપણું ભૌતિક તેમ જ ઉપાસનકીય તમામ કાર્યોમાં - પ્રક્રિયાઓમાં જ્ઞાનતંત્રોએ તન્મય ને તદ્દાકાર થવાં જ જોઈએ.

ઉપાસનાના આરંભથી આત્મસાક્ષાત્કાર શુદ્ધીના સમયમાળા ફરમિયાન ઉપાસનાકીય ને આધ્યાત્મિક ને કે પરિખળે। પ્રગતિ સાધવામાં ઉપકારક જાણિત થયાં છે તે બધાને આત્મસાત્કરવાની સમર્પણ પ્રક્રિયા તપશ્ચર્યાં છે. એ એક માનસિક-ચૈતસિક-ચૈતનાના ચિંડા સ્તરથી સિદ્ધ થઈને ખાલી આવે છે. એ સિદ્ધ કરવા ને આયાસ કરવો પડે છે, ને કપરા કાળમાંથી પસાર થવું પડે છે તે બધાં જ પરિખળે। એકન થઈને માનવીને તાવી નાખે છે. તેના મનની ભલિનતાઓને દૂર કરે છે, સાત્ત્વિકતા-પવિત્રતા જન્માવે છે. ઉપાસના-આધ્યાત્મિકતામાં આગળ વધારી આત્મસાક્ષાત્કાર શુદ્ધી પહોંચાડે છે, સાક્ષાત્કાર થાય કે ન થાય તે બૌધ્ધ વાત છે-હોંવી જોઈએ ને રહેવી જ જોઈએ. પણ કે માર્ગ ગ્રહણ કર્યો છે તે ઉપાસના-આધ્યાત્મિકતામાંથી ગમેતે થાય તો પણ ચલિત ન થવું ને મન, વચન ને કર્મથી પવિત્ર રહી જીવન જીવવું એ મોટી તપશ્ચર્યાં છે.

શ્રીદી, કરણાગતિ, મા-ખાળકનો અર્થ-ધ, એકાગ્રતા, પ્રેમસાવના, લગતી, જરૂરી ને છણ માટે તપ્રતા અને અનન્યતાના સ્ફુર્ત સ્પંદનો અર્થિત્વમાં જન્માવવામાં, દદ થવાં ને ચિરકાળપર્યાંત એને ઠકાવી રાખવા એ સમર્પણ અનોધ્યાપાર એક તપરયા જ છે-ધષ્ટી મોટી.

## પૂજય શુદ્ધુદેવના આરીવાદ

M. N. CHAMPAKERIA  
B. E. Civil (HONS), A. M. I. E. (INDIA)



## JANAK ENTERPRISE

1/29, NAVJIVAN CO-OPERATIVE HOUSING SOCIETY,  
LAMINGTON ROAD, BOMBAY-400 008

## અનુભૂતનું આચરણ

ડૉ. કાન્તિલાલ કાલ્પાણી

### ૨૫।

અનુભૂતિ માટે અહિર્મુખ થવાને અદ્ધલે અંતર્મુખ થવું અતિ આવશ્યક છે. અંતર્મુખ જતા હાસબ કરવા અહારના જંઝોઅં ગળાડ્યું રહેવાને અદ્ધલે અંતરની યાત્રા શરી કરવી પડશે એમ થશે તો જ અન્તઃકરણ પર મેળના જે થર ચડી ગયા છે તેને દૂર કરવાની શક્યતા નિર્માણ થશે.

આપણે આપણા મનોજગતમાં જેમ જોડા જિતરતા જઈશું તેમ આપણા ગુણ અને દોષ આપણને દેખાવા માડશે. પણ ગુણોની વૃદ્ધિ માટે અને દોષોના નિવારણ માટે શું કરવું તેનું ચિંતન શરી થશે. અનુભૂતિ વ્યક્તિગતોનો સહવાસ અને જ્ઞાનીજનો સાથેનો સત્તસંગ પણ માર્ગદર્શનનું કાર્ય કરશે. દૂંકમાં આપણે શું કરવાનું છે એ ચિત્ર રૂપી હોય અને સાચી દિશામાં પુરુષાર્થ હોય તો વહેલો-મેડો માર્ગ હાથમાં આવ્યા વિના રહેતો નથી.

પણ મોટે ભાગે આપણે અંધારામાં કંદ્દા મારતા હોઈ એ છીએ. નથી આપણને આપણા વ્યક્તિત્વનો ખ્યાલ હોતો કે નથી આપણી પાસે રૂપી ધોય હોતું. આવી સ્થિતિમાં આપણને અન્તર્મુખ થવાનું શી રીતે સહે ? એક પક્ષે આપણે ચૈતન્ય તત્ત્વની અનુભૂતિ કરવી છે અને બીજે પક્ષે આપણે ખાલી જગતમાં રમમાણ રહીએ તે કેમ ચાલે ?

ખાલી જગત સાથે ખપપૂરતો સંબંધ રાખીએ તો એ સંબંધ બહુ બાધારી નથી બનતો. પણ ખાલી જગત સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય અને આતિરિક જગત સાથેના આપણા સંબંધોનો વિચ્છેદ થઈ જાય તો આપણે અંતર્મુખ ન થઈ શકીએ.

સાધનાને માર્ગ જવું હોય તો અન્તર્મુખ થવું જરૂરી છે. અંતર્મુખ થઈ એ તો જ આપણે સ્વાતુભૂતિના માર્ગ ગતિ કરી શકીએ અને જગતને અપાતું પ્રાધાન્ય આપણા મનમાંથી આપોઆપ ઓછું થવા માડે. અત્યારે આપણી સ્થિતિ શી છે ? આપણે સૌનો અનુભવ છે કે મન નવરું હોય તો હેર હેર ભટકે છે અને પોતાની વિવિધ પ્રકારની ભૂખ સંતોષવા વલખા માર્યા કરે છે.

અહિર્મુખ છન્દિયો સાથેનો તેનો નાતો ક્ષીણું થઈ જાય તો ખાલી ખોરાક આપોઆપ એણો થવા માંડશે. એમ થશે તો મન, બુદ્ધિ, ચિત્ર અને અહંકારનું અનેલું અન્તઃકરણ પોતાનું ધ્યાન રાખવા માંડશે.

આપણે ધરતું બરાબર ધ્યાન રાખીએ તો એમાં ખાર્ચા-જળા ખાતરી નથી, કચરો એકડો થતો નથી કે જિધઈનું આકાશથું થતું નથી. તેવી જ રીતે જાયત રહી જે અન્તઃકરણની ચોકી કરે છે ત્યાં પૂર્ણા, વાસના, આવેગો, ઉપલેખો, રાગ-દ્રોષો, કોષ, લોભ, મોહ, મદ, મત્તસર વગેરે પોતાનાં યાણો જમાવવામાં સક્રિગ થતી નથી.

આપણે બેદરકાર રહીએ છીએ એટલે આ બધી વૃત્તિએ આપણામાં ધર કરીને રહે છે અને ક્ષાવે ત્યારે પ્રગટ થાય છે. આ વૃત્તિએ સાથે આપણે એટલો સહવાસ થઈ ગયો હોય છે કે તેમના વિના આપણને ચેન પડતું નથી. એમના સાનિધ્યને કારણે આપણને એમ લાગે છે કે આયુષ્ય કાંઈ જલદી ખૂબી જવાનું નથી. ધાર્થા વર્ષો સુધી આ જગતમાં રહેવાનું છે એટલે આપણે નિશ્ચિંત બનીને સોસારિક ખાખેતામાં રસ લેવાનું ચાલુ રાખીએ છીએ.

આપણે હળીએ કે ન હળીએ, પણ બણું લોડાને એવું હેતાં સાંભળીએ છીએ કે સંસારને સરખી રીતે માણ્યી લેવો, પછી આત્મચિંતન કરીશું. મોટા ભાગના લોડા આત્મચિંતનની પ્રક્રિયાને આધી ને આધી હેલતા જાય છે. તેમને ખ્યાલ નથી આવતો કે જે જીવનના પૂર્ણાંભાં નથી થયું, જીવનના મહેષાહનાંભાં કે પૌદાવરસાંભાં નથી સુજયું તે જીવનના ઉત્તરાર્ધાંભાં શી રીતે સામે આવાને જિલ્લાં રહેશે? સિનાય કે કોઈ મોટા આંચડો આવે અને મનુષ્યને ભૂલકાળ માટે પારાવાર વસવસો થાય. પણ એ આકર્ષિત ગણ્યાય. સામાન્ય રીતે જીવનપ્રવાહ પતિત હોય છે. ખીજ વાત એ કે જીવનના ઉત્તરાર્ધ સુધી આપણે જરતા રહીશું તેની કોઈ ભાતરી ભરી?

એટલે આપણે જીવનના ઉત્તરાર્ધની રાહ ન જોઈ એ એ છાણ છે. ‘આ જ ભાઈ અત્યારે — એ જ આચું સુત છે. એક સ્નેહીજનના ઐતરમાં ઘડિની મનુષ્ય ઇસલ લહેરાતી હતી. ઇસલ એકહમ તૈયાર હતી પણ ખેડૂન મિત્ર તે દ્વિસે ઘડિની લથુણી કરવા તૈયાર નહોતા. ઇસલ જોઈને સૌની છાતી ઇંદ્રી ન હોતી સમાની. મેં કહ્યું : ઇસલ તૈયાર છે પછી વિવંખ શા માટે કરો. છો : દ્વારિયાને બોલાવી લોને. તેમણે કહ્યું : એક દ્વિસમાં શું ખાડું-મોળું થઈ જાય છે? હું મૌન રહ્યો. અનવાકાળ છે તે ખીજે દ્વિસે પૂર્ણ દિશાઓથી સવારમાં જ ન કલ્પી શકાય તેણું મોટું તીડનું ટેળું આવી ચઢ્યું. ગામતું આખું આકાશ તીડોથી છવાઈ ગયું. અમે ઇળિયામાં ખાટલા પર ખેડા હતા. તીડો જોઈ સૌ ઇંદ્રી જિદ્યા. ગામના ઐતરામાં તીડો ન જીતરી પડે તે માટે સૌ પ્રાર્થના કરવા લાગ્યા. હાથની બાળ નહોતી, તીડેનું ટેળું કચા જીતર છે તે જેવા અમે સ્નેહીજનના ઐતર તરફ ગયા. જોયું તો તીડોએ આપેને ઢારે એવી ઇસલ પર જીતરાચું કર્યું હતું. મહાન આગમાં સપડાય તો આગ એલાવા આખાલાળાને બોલાવી શકાય. અહીં કહ્યું થઈ શકે તેમ નહોતું. શ્રોડા સમયમાં ખેળ ખતમ થઈ ગયો.

નણેક મહિનાની ડાળી મજૂરી, ખર્ચેલાં નાણી અને સમય પર વિતાશક મોજું હી વળ્યું. જેણૂતો પર હુંખના હુંગર તૂરી પડ્યા હોય તેવું લાગ્યું. પણ કોઈ ઈલાજ નહોતો. સ્નેહીજન સાને બેડા સ્વસ્થ થયા ત્યારે કહેવા લાગ્યા. તમારી વાત માની હોત તો સાચું થાત. આળસ ન કરી હોત તો અનાજ ધર બેગું થઈ જાન. પણ કુમતિ સરી અને આળસ કરી દીધી.

જીવનની ઇસલ પણ કચારેક આમ લુંટાઈ જતી હોય છે. ડાળ એચિંતાનો આવી શકે છે, એટલે તો સમજું લોડાએ જિંદગીને ચાર દ્વિસતું ચાંદરણું કહ્યું છે. જીવનનો કોઈ ભરોસે નથી. પલકવારાંશું શું બની જાય તે કહેવાય નહીં. જેણું જીવનમાં સિદ્ધ કર્યું તેણું આપણું. આવતી કાલ ઉપર શા માટે મુખતરી રાખવું?

પરમાત્મા સાથે તાર જેડવો છે, તો આજે જ, અત્યારે જ ભગવત્તરમરણ અને ચિંતન કરવા માંડવાનું. રાહ જોવાની જરૂર નથી. ભાવસભર હૃદય હોવું જરૂરી છે. હૃદયમાં ભક્તિનું વાવેતર થવા મારું એ છાણ છે. હૃદયમાં તો જેવું વાવીએ તેવું જાગે. ધર્માં લોડા સંસારની લમણ્યાઝીકાથી જીવનને ભરી હે છે, પછી જીવનભર એમાં જ ગૂંચવાયા કરે છે એટલે કાળજી રાખવાની જરૂર છે. ભગવત્તરમરણમાં હુંથી જવાની જરૂર છે.

આવું કચારે શક્ય અને? અંદરથી નામરમરણું સરવાણી કુટે ત્યારે. નામરમરણ પ્રયત્નપૂર્વક થાય તાં સુધી અંદરનું જગત ઉત્ત્વચિત્ત થતું નથી. વ્યક્તિ જ્યારે અંદરથી થતા નામરમરણને એક ચિત્ત સાંભળે છે ત્યારે પરિસ્થિતિ પલટાઈ જાય છે. એમાંથી જે આંનંદ મળે છે તે અવધીનીય હોય છે.

સહજ આવે થતું નામરમરણ ચૈતન્ય શક્તિને ઝંકું હી દે છે. અંદરનું તંત્ર સમગ્રપણે ઝણકણી નીઠે  
છે તારે એનો રણકાર સમગ્ર લુચનમંડળમાં જ્યાપણ એવા પરમતત્વ સુધી પહોંચી જાય છે. આપણે  
આવું નામરમરણ કરીએ છીએ? ના. આપણે ઈશ્વરભક્તિને આડંખરની સણી બનાવી દીધી છે.  
ઇન્દ્રિયોને આનંદ પડે એવું આપણે કરીએ છીએ. મોટા મોટા મંહિરો બાધીએ છીએ અને તેમાં મૂલ્ય-  
વાન આરસની મૂર્તિએ પદરાણીએ છીએ. હા મંહિરાની જરૂર છે બણા લોકાને ત્યાં શાંતિ અને આનંદ  
મળે છે, પણ જેમણે અધ્યાત્મ માર્ગ જ જવું છે, સ્વાતુભૂતિ કરવી છે તેઓ માત્ર બાલ્ય પ્રક્રિયાંથી  
રોકાઈ જાય તે ઈંદ્ર નથી.

નહીં તરવા માટે જેમ નૌકાની જરૂર પડે છે તેમ નામરમરણ ખાસોચ્છવાસ સાથે જોડાઈ લાખું  
આપણી રગેરગમાં પ્રસરી જાય તે માટે મંહિર, ધૂપહીપ, માળા વગેરે સાધનો જરૂરી છે. પણ આપણે  
આખી જિંદગી આ સાધનોને વળગી રહીએ અને સાધ્ય તરફ આપણી ગતિ જ ન થાય તો સાધનોનો  
અર્થ શા? બને તેટલું વહેલું સાધન છોડી દેવાનું છે અને સાધ્યમાં સ્થિર થવાનું છે એવી જગતિ  
રહેવી જરૂરી છે.

છાપરા પર પહોંચવું હોય તો સીડી આવશ્યક છે. સીડીના એક પણી એક પગથિયાં ચડીને  
આગળ વખવાનું છે. એમ કરીએ તો ઉપર પહોંચી જઈએ. પણ તેને બદલે સીડીને જ વળગી રહીએ  
તો, સીડીને જ જાંયકીને ફર્યા કરીએ તો? તો જાંખ્યો ગતિ નહીં થાય, અનુભૂતિ નહીં થાય. એટલે  
કે સીડી લઈને ફરનાર વ્યક્તિને છાપરાનો રસ્તો નહીં થાય.

અહીં સાધનોની છે જોડાડવાની વાત નથી. સાધનનું મહત્વ જે જ. પરમતત્વને પાભવાની માટે  
પરમ પ્રેમ એક અમોદ ઉપાય છે. હૃદયમાં પરમાત્મા માટે અને તેમનાં સર્જન માટે નિર્ભેણ પ્રેમ  
જને છે તારે તેમને પાભવાનો રાજમાર્ગ ખુલ્લો થઈ જાય છે.

આવા પ્રેમ મૂલ્ય ચૂકુંયા વિના મળતો નથી. સમગ્ર પ્રાણ જ્યારે પરમ શક્તિને સમર્પિત થઈ  
જાય છે તારે દ્વિષ્ય પ્રેમનું પ્રગટીકરણ થાય છે. આવા પ્રેમના સાનિધ્યમાં અહંકાર નામરોષ થઈ જાય  
છે. અહંકારનું એગળી જવું એ જ ખરો પ્રેમ છે.

હૃદયમાં પ્રેમનો હીપણ પ્રગટે પણી અંધકાર રહેતો નથી. જગત પ્રત્યેના રાગ-દ્રોષ પણ હૂઠી  
જાય છે અને સ્વીકારની ભૂમિકા રચાય છે. આ સ્થિતિમાં વિરોધ માત્રનું શમન થઈ જાય છે અને  
રચના. માત્ર પરમાત્માની લીધા છે એવી પ્રતીતિ થાય છે. કહેને કે પ્રેમનું વિશાળ દ્વારા ઘૂંઠી જાય છે.  
પણ ‘હું’ની હાજરી રહેતી નથી. હરિની હાજરી સર્વત્ર વર્તાય છે.

આવા અનુભવ કરવા અનલ્ફુલ્ફ થવું અનિવાર્ય છે. મનોજગતને દોઢોળવું જરૂરી છે અને  
લાઘેદો માર્ગ ચૂકો ન જઈએ એ માટે સત્તસંગ આવશ્યક છે. આટલી કાળજી હશે તો અંધારામાં  
હૃદાં મારવાને બદલે આપણે સ્વાતુભૂતિના પણ પર ગતિ કરી શકીયું અને આ કાર્ય આજે જ હાજર  
થરવાનું છે.



# ઉપાસનાના આરંભે

**કુ** ઈ પણ ઉપાસક આધ્યાત્મિક-ઉપાસના ક્ષેત્રે સૌ પ્રથમ પદાર્પણ કરે છે ત્યારે તેને પ્રેરણા, પ્રેતસાહન, બળ અને આરાધ્ય તત્ત્વનાં દર્શનની-જાંખીની સ્વાભાવિકપણે જ અપેક્ષા અને અનિવાર્યતા રહે છે.

આવી વ્યક્તિ જ્યારે કોઈ સન્તના સાનિધ્યમાં રહી તેમના માર્ગદર્શન અનુસાર ઉપાસના આદરે ઉત્તમારે તેના દિલની દર્શનની-જાંખીની અપેક્ષાને આકાર આપવા પરમાત્મા-માતાજી તે તે સન્તના સ્વરૂપમાં દર્શન આપે છે અથવા તો એ સન્તને સ્ફુર્ત રીતે નિજના સ્વરૂપની, આધ્યાત્મિક શક્તિ દારા, જાંખી કરાવવા પ્રેરણા કરે છે જેને પરિણામે ઉપાસકને અતે વર્ષાંયા પ્રમાણેના અનેકવિધ અનુભવો બાધ છે. ઉપાસકની દૃષ્ટિની કાવના-અપેક્ષા આ રીતે સાકાર થતાં તેની શક્તિ અને ગરણાગતિ વિરોધ દ્વારા બને છે, તેનામાં અનેરો ઉત્સાહ જાણે છે અને બેનડા વેગથી તે ઉપાસનામાં પ્રવત બને છે.

અમદાવાદના જયેશ બ્યાસે પોતાનો સ્વરૂપનો એક અનુભવ વર્ણવતાં જણાયું હતું કે, ‘એક રાત્રે હું નવરાત્રીના ગરબા જોઈને પાછો દરી રથો હતો, ત્યારે એક અનાદ્યા વિસ્તારમાં નીકળી ગયો. સાચો રહતો જાણુવા એક-એ જણુને પૂછતો હતો ત્યા એક મહાનની અગાશીમાં શુદ્ધેવ રીતે પતી ગયું?’ (નવરાત્રી દરમ્યાન મેં શુદ્ધેવના આશીર્વાદ લઈ અનુષ્ઠાન કરેલું) મેં ‘હા’માં જવાન આપે. મારી આંખો ખૂલી ગઈ. દરી મીંચાઈ, દરી સ્વરૂપમાં સુલાક્ષણ થઈ, મેં તેમને જણાયું હે દર વખતે અનુષ્ઠાન પણ હવત કરું છું પણ આ વખતે ક્યોરી નથી. શુદ્ધેવ જણાયું હે આદે, એવી જરૂર નથી. ત્યાર બાદ મેં મારા વર્ષોથી મૂંઝવતો પ્રશ્ન પૂછ્યો. તેમણે જણાયું હે, તે મારા ધ્યાનમાં છે. તમારી દ્વેક સુલાક્ષણની મને જાણુ થઈ જ જાય છે.

સ્વરૂપ વેળાનું રથળ તથા તેમની આસપાસ રહેલ વ્યક્તિઓ અનાદ્યા હતી. ડેઢલુંક અવારસ્તવિક પણ હતું. અત્યાર શુદ્ધેવના દર્શનની મને ખૂબ આનંદ થયો.

આ વખતે મેં માતાજીને પ્રાર્થના કરેલ કે હું આપવા દર્શનને તો લાયક નથી પણ મને જે શુદ્ધેવના દર્શન થશે તો જરૂર આનંદ થશે. મારા ધ્રુંધા પૂર્ણ થઈ.’



મા જાયતીની કૃપા અને  
પુ. શુદ્ધેવના આશીર્વાદ હરદ્દેશ  
વરસતા રહેલ એવી નામ વિનાંતિ સહ  
જમનાદાસ નાગરદાસ મેહી  
જનરલ મરચન્ટ  
‘માગનીતી’  
જિવાડા - R. No. ૩૬૧૧૮૫ (ડિ. વલસાડ)



# સૂક્ષ્મ ઉપસ્થિતિ

**મા**નવીના આતરમનની ઊંડી, શ્રદ્ધાપૂર્વકની શરણાગતિ અને સમરણનું સાતય તેને આધિ-ધ્યાધિ-ઉપાધિમાંથી મુક્તા કરે છે કે રાહત આપે છે, પણ તેને પરિણામે ભાનવી-ઉપાસક અજણુપણે જ ભાતાળ સાથે-ગુરુ સાથે સૂક્ષ્મ અનુસંધાન સાધી બેસે છે. આતરમનનું આ સૂક્ષ્મ અનુસંધાન થતો જ મુશ્કેલીની પગામા તેતું સમરથ આદરતો જ ભાતાળ શુદ્ધેવની સાથે સૂક્ષ્મમહે તે ઉપાસકને દર્શન આપી ફૂટાર્થ કરે છે અને તેને ઉપાધિમાંથી-મુશ્કેલીમાંથી મુક્તા કરે છે. અને આવો જ એક રસપ્રદ પ્રસંગ પ્રસ્તુત કર્યો છે.

નવસારીથી શ્રી સુમનભાઈ નાયક લખી જણાવે છે કે, 'પરમ તેજદાયી ગાયત્રી માની અસીમ કૃપા અને શુદ્ધેવના અત્યંત લાગણીભર્યા આશીર્વાદથી મારી તથિયત હવે ધણી જ સુખારા પર છે. તા. ૮૮ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ સાંજે ૬-૩૦ થી ૭-૦૦ ના ગાળામા મને હંદ્રયરોગનો ફુમલો થયો. તે દરમ્યાન હું ઓહિસમાં મારું કામ કરતો હતો. મને ઢીક ન લાગતો ડોક્ટરને જીતાવ્યુ. અને તાત્કાલિક જ સુરતની મહાવીર હેરપીટલમાં ખસેડવામા આવ્યો. માની કૃપા અને શુદ્ધેવના આશીર્વાદ હેઠું કામ કરે છે તે જેવાતું છે. Attack ધણો જ તીવ્શ હતો. પણ તે દરમ્યાન મને પૂરેપૂરું લાન હતું. મને હંદ્રયરોગનો ફુમલો છે તેની વાત મેં ડોક્ટરને રૂપણ કરી હતી. સાંજ માણુસ વાત કરે તે જ રીતે હું તેમને વાત કરી તાકીદે સુરત ખસેડવા જણાવતો હતો. રાતે દસેક વાગ્યે અમે સુરત પહોંચ્યા. તે દરમ્યાન મને એમ્યૂલન્સમાં સુવડાવવામા આવ્યો હતો. ત્યારે મારા મન ઉપર ડોક્ટર જ ટેન્શન નહોતું. હું સમૃદ્ધ સ્વરથતાથી સુતો હતો. ડોક્ટરને ઓફિસજનતું ધ્યાન રાખવા જણાવતો હતો. આ બધી કહ્યા દરમ્યાન મારી આસપાસ મારા માયા આગળ પૂજય મા બેઠા હતો અને શુદ્ધેવ પણ ત્યા જ સામેની સીટ પર બેઠા હોય એમ રૂપણ લાગતું હતું. મારા ગાયત્રી મંત્રના જ્યાં ચાલુ જ હતા. ગાડીમાં ડોક્ટર, મારો ભિસિસ અને અન્ય ભાઈઓ હતા, તેમ છતો તેમનો મને પૂરેપૂરો ધ્યાલ રહેતો ન હતો. પૂ. મા મારી બાજુમાં અને શુદ્ધેવ મારી સામે બેઠા હતા. શુદ્ધેવ પોતાના નિય હાસ્યવદનથી મને જણાવતા હતા. કે હશું નથી. મારું થઈ જશે. તું તારા જ્યાં ચાલુ રાખ. શુદ્ધેવના આશીર્વાદ અને પૂ માની પરમ કૃપાને વર્ણવવાના મારી પાસે શખ્ફો નથી. '૮૪ ના જાન્યુઆરી માસના અંકમાં પ્રગટ થયેલ 'તપશ્ચર્યા'નો લેખ એ એક યોગીની વાણી છે. આ લેખ વાગ્યા પણ મને એવું લાગ્યું કે હું ડોક્ટર યોગીના ઘોગણન કરી રહ્યો છું.'

શ્રી ગાયત્રી માતાળની કૃપા અને પૂજય શુદ્ધેવના આશીર્વાદની અસ્થર્થના

— : શ્રી અંબિકા સોઅ ઈકટરી અને ટી ટેપો : —

— : શ્રી અંબિકા કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ : —

— : શ્રી જ્યાં અંબે સોઅ એન્ડ ટી સેન્ટર (રીટેઇલ વિલાગ) : —

૪/૧૩૩, હરિપરા પીરછડી રોડ, અંબિકાસહન, સુરત-૩

"ડીટરજન્ટ સાયુ તથા વોશીંગ પાબડરના ઉત્પાદક"

# કાચ્યપ્રસાદ

[ શુરૂપૂર્ણિમા નિમિત્તે શ્રી તપસ્વી નાન્દીએ રૂચિલ ક્રોડે અને ભરતુલ કર્થી ૩.]

સમાયાતા તુ પૂર્ણિમા ।

રચિતા : ડૉ. તપસ્વી નાન્દી

ભવચ્છેદકરી હોષા સર્વપાપવિનાશિની ।  
ચતુર્વર્ગસ્ય પ્રાપ્ત્યર્થ આગતા ગુહપૂર્ણિમા ॥ ૧ ॥

આ (= શુરૂપૂર્ણિમા) લવ (= જન્મ-મરણના ચક)નો છેદ કરનારી છે તથા બધાં પાપનો વિનાશ કરનારી છે. ચતુર્વર્ગ (= ધર્મ, અર્થ, કામ અને મોકાશ)ની પ્રાપ્તિ માટે શુરૂપૂર્ણિમા આવી છે. ॥ ૧ ॥

ગુરો: ચરણસ્પર્શસ્તુ પ્રાળિનાં મોકારક:  
સર્વસુખપ્રદશૈવ પરકલ્યાણસાધક: ॥ ૨ ॥

શુરૂજુનો ચરણસ્પર્શ બધાં પ્રાણીએ માટે મોકારક છે. તે સર્વ પ્રકારનાં સુખ આપનાર છે તથા પરમકલ્યાણનો સાધક છે. ॥ ૨ ॥

સર્વકિલ્બિષઘાતાય તમોવિઘ્નજયાય ચ  
સર્વસંશયનાશાય સમાયાતા તુ પૂર્ણિમા ॥ ૩ ॥

બધાં પાપના નાશ માટે, અંધકારદ્રષ્ટી વિદ્ધિ ઉપર વિજય મેળવવા માટે તથા બધા જ સંશયે દૂર કરવા માટે આ પૂર્ણિમા આવી ગઈ છે. ॥ ૩ ॥

પૂર્ણિમાચન્દ્રકા હોષા સર્વતાપવિનાશિની ।  
ગુહચન્દ્રપ્રભાવેન સુતરાં સા ફલપ્રદા ॥ ૪ ॥

પૂર્ણિમાની ચાંદની બધા તાપનો વિનાશ કરનારી છે. પણ શુરૂરૂપી ચંદ્રના પ્રલાવથી તે વિશેષ ક્રૂળ આપનારી અને છે. ॥ ૪ ॥

આનન્દસાગરો હોષ: સમુચ્છલતિ મે હૃદિ ।  
નૈસર્ગિકી તથા શાન્તિર્લભ્યતે ગુહચન્દ્રનાત ॥ ૫ ॥

મારા હૃદયમાં આનન્દનો સાગર ઊછળે છે. શુરૂજુના વંદનથી સ્વાભાવિક શાન્તિ આપત થાય છે. ॥ ૫ ॥

□

## સુમારી

\* તા. ૧૮-૧-૮૮ પૂજય શુક્રવર્ષની સુધીની ચિ. મિતાના શુલકાન.

\* મહેસાણામાં શુક્રવર્ષ (શાખીલ)ની વ્યક્તિગત મુલાકાત તેમજ અગિયાર કુંડી ગાયત્રી -મહાયજન આચોજન કરવામાં આવ્યું છે.

\* તા. ૧૯-૨-૮૮ ને શનિવારે વ્યક્તિગત મુલાકાત ને અનુભબમાં કાર્યક્રમ.

સમય : અનેરે ૧ થી ૫ વાગ્યા સુધી.

તા. ૧૪-૨-૮૮ ને રવિવારે અગિયાર કુંડી ગાયત્રી-મહાયજન.

સમય : સવારે ૬ થી સાંજે ૫ વાગ્યા સુધી.

વ્યક્તિગત મુલાકાત અને યજસ્થળ : ડૉ. જશવંત આર. સેની, ૧૧૬/૧૧૭,  
પાર્શ્વનાથ સોસાયટી, વાગ્લપુર રોડ, કોલેજ પાસે, મહેસાણા. ઇન નંબર : ૨૦૬૮૭

\* તા. ૧૬-૩-૮૮ થી તા. ૨૬-૩-૮૮ આઠ દિવસની ચૈત્રી નવરાત્રી છે.

અનુષ્ઠાન કરવા ઈચ્છિતાં લાઈબલેનોને પૂજય શુક્રવર્ષના આશીર્વાદ.

\* તા. ૧-૫-૮૮ થી પરચીશ દિવસનો પૂજય શુક્રવર્ષનો અમેરિકાનો કાર્યક્રમ છે.  
પ્રોઆમના આચોજન અને અન્ય વિગતો માટે ન્યુજસીસીમાં શ્રી પ્રવિષ્ટલાઈ ડેક્ટરનો  
સંપર્ક સાધબો.

ઇન નંબર : 201 - 451 - 4703

\* ૧૯૮૮ ના વર્ષનું આપનું લવાજમ રીન્યુ કરાવી લેવા વિનાંતિ.



મા ગાયત્રીની કૃપા અને પૂ. શાખીલના આશિષ અમ સૌ  
પર અવિરતપણે વરસતા રહેલી એવી અસ્થર્થના સહિત

**NARENDRA  
PROCESSING  
INDUSTRIES**

Tele. : Factory : 41177 \* Resi. : C/o 42689



33-1, Plot No. 1, Behind Sub-Jail, Khatodra,  
SURAT - 395 002

[ આધ્યાત્મિક કેડી, નાન્યુઆરી, '૮૮



ગાયત્રી-ઉપાસક પુ. શ્રી શાસ્ત્રીજી



## પૂજ્ય ગુરુદેવની મુલાકાત

\* આધિ, વ્યાધિ, ઉપાધિથી પ્રસ્ત ડોઇપણ વ્યક્તિ, શાતિ, જાતિ, સર્પધાય કે ધર્મનાં બન્ધનો સિવાય વિનામૂહ્યે પૂજ્ય ગુરુદેવની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવી શકે છે. પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન બને તો પણ પૂજ્ય ગુરુદેવના આદેશ અનુસાર ગાયત્રી મહામંત્રની પણ માળાને જીવનના અનિવાર્ય દૈનિક કાર્યક્રમમાં વણી લેજો.

મુલાકાત સ્થળ : ‘નીલોખા’ બંગલા, નિમૂતિં સોસાયટી, અવન્મેન્ટ પાંચ બંગલા પાસે, ગુલમોર ફ્લેટ્સ પાછળા, ગુલબાઈનો ટેકરો, અમદાવાદ-૧૫.

સમય : અપોરના ૧૨-૦૦ થી ૨-૦૦ (૧૦૧ વ્યક્તિને મુલાકાત)

શનિ-રવિ તથા જાહેર રજના દિવસે બંધ.

\* પૂજ્ય ગુરુદેવ આપના પત્રો વાચે છે, પરંતુ લેખિત જવાબ પાડવતા નથી.

\* શારીરિક-માનસિક રોગો માટે પૂ. ગુરુદેવ જીવનજળ આપે છે. સ્વર્ગ ખાલી ખાટલી સાથે લાવવી, જેથી અભિમંત્રિત જીવનજળ આપી શકાય.

